



# વિહંગ

પક્ષીનિરીક્ષકો વર્ચ્યોનો જોતુ - ટ્રેમાસ્ટિક

શિક્ષિક ૨૦૦૨



પચામર્શક : લાલસિંહ રાઓલ

સંપાદક : ડૉ. બન્દુલ ત્રિવેદી



## પંખીપુસ્તક પરિચય શ્રેણી - ૫

‘આપણે આંગણે ઉડનારાં’

લેખક : નિરંજન વર્મા, જ્યમલ પરમાર

રાજકોટનું દેસિક ‘કૂલછાબ’ પહેલાં અભવાડિક હતું અને અમદાવાદ જિલ્લાના રાષ્ટ્રપુર નામના તાલુકા મથકેથી પ્રસિદ્ધ થતું. શ્રી જવેશયં મેધાશીએ વરસો સુધી તેમાં કામ કરેલ. તે જ પ્રમાણે, શ્રી નિરંજન વર્મા અને શ્રી જ્યમલ પરમાર પણ તેમાં હતા. તેમણે ‘આપણે આંગણે ઉડનારાં’ નામે એક લેખમાળા ‘કૂલછાબ’માં આપેલી. તે વખતે તે લોકપ્રિય થયેલી અને ૧૯૪૨માં પુસ્તકરૂપે તે પ્રસિદ્ધ થઈ. પક્ષીઓનો પરિચય કરાવતું ગુજરાતી ભાષાનું તે પહેલું પુસ્તક. તેની બીજી આવૃત્તિ પણ ‘કૂલછાબ’ આજાદી પહેલાં બધાર પાડેલી. તેના મુખ્ય વિકેતા હતા, ‘નવયુગ પુસ્તક ભંડાર’, રાજકોટ.

પ્રાજ્ઞવનમાં પક્ષીઓ કેવાં વણાઈ ગયાં છે અને શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકણ અને ભરતકામયમાં પંખીઓને કેવું સ્થાન મળ્યું છે, તે વિશે પહેલા ગ્રંથસમાં લેખકોએ વીગતે લખ્યું છે. લાકડાંના મોર કે પોપટથી લોકોએ મકાનો શરૂગાર્યાં છે. પાણીના ગોળાના પિતળના બુગારા પર તેમજ સાડી-સાબુમાં, ચખૂતરા અને પરબોમાં, એમ અનેક સ્થળો મોર અને પોપટ જેવાં પંખીઓને સહજપણે સ્થાન મળેલું છે. ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ તથા ‘ઈસપની વાતો’માં પંખીઓ પ્રાધાન્ય બોગવે છે. લોકકથાઓમાં, કહેવતોમાં, ભજનોમાં, લગ્નગીતોમાં અને મૃત્યુગીતો (મરણિયા)માં પણ લોકોએ પક્ષીઓને કેવાં વણી લીધાં છે, તેનાં લેખકોએ ભરપૂર ઉદાહરણો આપ્યા છે.

ભેતીમાં ઉપકારક તરીકે, દવાઓ, ખાદ્ય કે સંદેશવાહક તરીકે, નૃત્ય, રૂપ અને રંગના નિર્દર્શકો તરીકે, પાંજરામાંના પાલ્ય તરીકે, એમ વિવિધ રૂપે પક્ષીઓનું આપકા જીવનમાં કેવું સ્થાન છે, તે વીગતે દર્શાવ્યું છે. દેવ-દેવીઓનાં વાહન તરીકે વિવિધ પક્ષીઓને ધર્મમાં મળેલ સ્થાન તરફ પણ લેખકોએ અંગુધિનિર્દેશ કર્યો છે.

શિશુના ઘોડિયે લટકાવેલ મોર કે પોપટના રમકડાથી પક્ષીપરિચય શરૂ થાય છે. બાલ્યાવસ્થામાં દાદા-દાદી પાસેથી વાતાવરો માર્કફટ આ પરિચય આલુ રહે છે. ડિશોરાવસ્થામાં લોકકથાઓનાં વાચન દ્વારા, ડિશોરીઓ અને સ્ત્રીઓનાં

ગીતોમાં, યુવાનોના દુદ્ધાઓમાં તે પરિચય આગળ વધે છે. સારસ, બપૈયા, ચાતક, ચકલા-ચકલીનાં ઉદાહરણો દ્વારા વિરહીજનોની વેદના અંગે લોકસાહિત્યમાં પક્ષીઓના કેવા ઉલ્લેખો છે, તે તરફ લેખકોએ ધ્યાન દોર્યું છે.

બીજા પ્રકરણરૂપે ગુજરાતના સમર્થ પક્ષીવિદ્ય અને પ્રકૃતિવિદ્ય શ્રી હરિનારાયણ આચાર્ય ‘વનેચર’ની વિસ્તૃત પ્રસ્તાવના રસિક વાચન પુરું પાડે છે. તેમાં તેમજો, પક્ષીજીવનની અનેક સમસ્યાઓ પર કેટેટલું કરવાનું બાકી છે, તે દર્શાવ્યું છે.

આપણી આસપાસ સહેલાઈથી જોવા મળતાં ઉદ પક્ષીઓનો વીગતપ્રયૂર પરિચય નશસો પૂર્ણોમાં આપ્યો છે. લેખકોની બાધામાં સૌરાષ્ટ્રની બોલીની છાંટ હોવાથી પુસ્તકનું વાચન વધારે રસપ્રદ બન્યું છે. જેને પક્ષીઓ વિશે કોઈ લગાવ ન હોય તેવાઓ પણ આ પુસ્તકના વાચનથી તેમાં રસ લેતા થઈ જાય એવી રમતિયાળ તેની લખાવત છે.

પુસ્તકનાં નાના નાના છકીકત-દોષોછેખર, દા.ત. લેખકોએ કાગળનું આધુણ્ય ૧૦૦ વરસ ગણ્યું છે. તે જ પ્રમાણે મોટા ધૂવડ (Great Horned Owl) કાગળનાં ઢિંગનો સોથ બોલાવી દે છે, તેમ જ્ઞાનાંથી છે. એક એક ગામયમાં કાગડાની સંખ્યા ૧૦-૧૫ હજાર જેટલી માની છે. પૂ.૭૫ પરના છેલ્લા ફકરામાં, લેલા (Large Grey Babbler)ના આખારોપાદનનું જે વર્જન છે તે રીત લક્કડાંદાની છે, લેલા તેવું કરતાં જોવામાં આવ્યાં નથી. લેલાનું અંગેજી નામ Large Grey Babbler ને બદલે Jungle Babbler આપ્યું છે. કાબરને તથા દેવચકલીને લેખકોએ ચકલીની માફક બે પગે ઢેકડ મારી ચાલતાં વર્ણિયાં છે, તે બાબર નથી. તેઓ આપણી માફક એક પણ ઉપાડીને ચાલે છે. પાળેલો બીમરાજ (Racket-tailed Drongo) માણસની બોલીનું અનુકરણ કરી શકે છે, તેમ જ્ઞાનાંથી છે. પક્ષીઓ અંગેના કોઈ પુસ્તકમાં આવો ઉલ્લેખ મારા જોવામાં આવ્યો નથી. હા, બીમરાજ ખૂબ અનુકરણપણું છે અને જાતજ્ઞતાનાં પંખીઓની બોલી કરી શકે છે, તેનો મને પૂરો અનુભવ છે. મેના (Hill Myna)ને લેખકોએ ગાનશિરોમજી કહી છે! મેના માનવબોલીનું સરસ અનુકરણ કરી શકે છે ખરી, પણ તે ગાયક નથી. ચામાચીદ્યા રાતના વખતે ચકલીઓને સારી પેઠે મારી ખાય છે અને એ રીતે ચકલીઓની (અનુસંધાન પા. નં. ૨૨ ૬૫૨)

## સ્વીચ્છા

પુજુતાઇપરિયાચ શેલ્ફ - ૫  
‘આપણે આંગણે ઉડનારાં’



વિહંગાવલોકન  
પક્ષીનિરીક્ષણનો આનંદ

નિરીક્ષણ નોંધ

- પોળો પાસે કાબરી રામચકલી
- ડાંગની મુલાકાત
- રાજકોટએં થામશિર મુનિયા

ટચ્છુલ્કા નોંધ

શાકસ વોચ

જીધ પર જાપતો

પત્રબોતુ

ખડકમોર

મ.છુહિમતાખણી લલમે

માઝાં પ્રદૂષિતશુદ્ધાંપુરીએં

અભ્યાસની પરંપરા

આવરણ

ખેરખંડો (Indian Treepie)

છલ્લિકર : મુકેશ ભંડ, સુરત

દેખા વિદ્રો : ડૉ. બંદુલ ત્રિવેદી

૪

૫

૬

૭

૮

૯

૧૦

૧૧

૧૨

૧૩

૧૪

૧૫

૧૬

૧૭

૧૮

૧૯

૨૦

૨૧

૨૨

૨૩

૨૪

૨૫

## સંપાદકીય



મિત્રો, ‘વિહંગ’નો આ અંક મળશે ત્યારે

શિયાળુ પક્ષીનિરીક્ષણ તેના અંતિમ ચરણમાં હશે.

પક્ષીનિરીક્ષણના વિવિધ કાર્યક્રમોમાં આપ સૌ વ્યસ્ત

રહ્યા હશે. ગત વર્ષ ચોમાસું ઢીક ઢીક હતું, છતાં છૂટક છૂટક વરસાદ આવવાને લીધે તથા પાણોત્તરા વરસાદના સંપૂર્ણ અભાવને લીધે મોટા ભાગનાં જળાશયો ખાલી રહ્યાં હોવાના સમાચાર મણ્ણા. પક્ષીસંરક્ષણ મંડળ, ગુજરાતના ઉપક્રમે, અંતરિયાળ જળાશયોના સર્વેક્ષણ અર્થે ઉત્તર ગુજરાતનાં કેટલાંક બંધસર્જિત જળાશયોની અમે ૫-૬ જીન્યુ. ’૦૨ તથા ૧૨-૧૩ જીન્યુ. ’૦૨ના રોજ મુલાકાત લીધી. બધે પાણી ઓછાં હતાં. આ પ્રવાસની શિરમોર ઉપલબ્ધી હોય તો તે, સફેદ સુરખાબ (Common Shelduck)નું અવલોકન. તા. ૨૭-૧-૦૨ના રોજ શ્રી ઉદ્ય વોરાએ દાંતીવાડા જળાશયમાં ૧૦ સફેદ સુરખાબની નોંધ કરી. એક સહજ અંદાજથી, કુલ પક્ષીઓની સંખ્યા પણ ઓછી લાગી. આપના અનુભૂતિઓ અમે અવલોકનો નોંધ કરી. બેઠાં.

વનવિલાસ તરફથી દર બે વર્ષ થતી નણસરોવરની પક્ષીગણતરી આ વર્ષ પણ રાનેતા મુજબ થઈ. પક્ષીગણતરીમાં સાતત્યાં મહાત્વ છે. સાતત્ય હોય તો મેળવેલાં પરિજ્ઞામોની અર્થપૂર્ણતા વધે. પક્ષીગણતરીની સાથે, નણસરોવરની જીણવણી અને વિકાસના દરેક તબક્કામાં પક્ષીનિરીક્ષણ સંકળાય એ ઈચ્છાનીય છે. ગણતરીના કાર્યક્રમ દરમિયાન થયેલા વિચાર-વિરસમાં, નણસરોવરની આસપાસ વસતી તથા તેના ઉપર નિર્ભર, અતિ ગરીબ પ્રજાને લક્ષમાં લીધા વિના આ અભ્યારણયના પ્રશ્નો ઉકેલી શકાય નહીં, એ વ્યાપક રીતે સ્વીકૃત મતનું દર્શિકરણ થયું. આપણે સૌ પક્ષીનિરીક્ષણ મિત્રો પણ આવા પણત અને દરિદ્ર સમાજના ઉત્થાનમાં થોડો સહયોગ ન આપી શકીએ? અને તે માત્ર પ્રદીપવરણની જીણવણીમાં તેમનો સહકાર મેળવવાના હેતુથી જ નહીં, પણ એક માનવતાની દાખિલા.

પક્ષીસંરક્ષણના આપણા અભિયાનને વેગ આપવો હોય તો સૌએ હાથ મિલાવવા જ પડશે. આપણે સૌ પોતપોતાની રીતે વિશેષ છીએ અને વિજ્ઞાગત યોગદાન આપી શકીએ તેમ છીએ, પણ આપણી પોતાની ભર્યાદાઓ અને ગુણ્ણો પણ છે. જો સાથે રહીશું તો પરસ્પર એકબીજાના પૂરક થઈને વધુ અસરકારક રીતે કામ કરી શકીશું. સાથે મળીશું તો આપણી તકાત અનેકગણી વધી જશે. આપણે સંયુક્ત અવાજ વધુ બુલંદ હશે. પક્ષીસંરક્ષણ મંડળ, ગુજરાત (Bird Conservation Society, Gujarat)નો જન્મ આ એક માત્ર હેતુથી થયો છે. BCSG તથા તેની કામગીરી અંગે વધુ માહિતી આવતા અંકથી અમે જુદા વિભાગમાં આપતા રહીશું.

અને છેલ્લે, તમારા વિસ્તારમાં વૈધાં (Rosy Pastor)ની સંખ્યા કેટલી રહી? તા. ૪-૨-૦૨ના રોજ માનનીય શ્રી લવકુમાર ખાયરે રાજકોટથી ફોન દ્વારા જીણાવું કે, આ વર્ષે રાજકોટ વિસ્તારમાં વૈધાંની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આપ સૌની વૈધાં અંગેની નોંધ અમેક્ષિત રહેશે.

## વિહંગ



વર્ષ - ૫ સાલના અંક ૧૫ શિશિર ૨૦૦૨

પરામણક સંપાદક  
લાલસિંહ રાઓલ ડૉ. બંદુલ ત્રિવેદી  
સંપાદક મંડળ  
પી.એસ.છક્કર, ડૉ. આર.બી.બલર, કે.ડી.વેણુવ  
પત્રવ્યવહાર  
૧૮/૪૧૪, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ,  
અમદાવાદ-૩૮૦૦૧૫

Email

vhangujarat@hotmail.com

લવાજમ : નિ:શુલ્ક (શુલેશ્ખા ફાળો આવકાર્ય -  
‘વિહંગ’ ના નામે ચેક/ડ્રાફ્ટ અથવા મ. ઓ.થી.)

પ્રકાશક : લાલસિંહ રાઓલ, સી-૨, ડિસ્કોમ  
એપાર્ટમેન્ટ, રાઇસ ઓફ ઇન્ડીયા પ્રેસ પાસે,  
જીવરાજ પાદ, અમદાવાદ-૩૮૦૦૫૧.

મુદ્રક : ડૉ. બંદુલ ત્રિવેદી, મુદ્રણસ્થાન : ‘શારદ  
પ્રકાશન’, પ્ર, સનપોર્ટ કોમ્પ્લેક્સ, ગુરુકુણ ટાવર  
સામે, અમદાવાદ-૩૮૦૦૫૨.

## વિહંગાવલોછન

લવકુમાર ખાયર  
(અનુ: ગ્ર. બહુલ નિવેદી)



### પદ્ધીનિરીક્ષણનો આનંદ

“તમે પદ્ધીનિરીક્ષણ કઈ રીતે કરો છો ?” “તમે પદ્ધીઓ જોવાનું ક્યારે શરૂ કર્યું ?” સમયાંતરે મારી ઉપર આ પ્રશ્નોનો ભારો થતો રહે છે. હવે કાળકમે જ્યારે હું પીઠ પદ્ધીનિરીક્ષકોની હરોળમાં મુક્કાયો હું ત્યારે, વારંવાર ‘પદ્ધી નિરીક્ષણ’ શીખવવા માટે મારા પર દબાણ થતું રહે છે. સાચું કહું તો, આ પ્રશ્નોના યોગ્ય જવાબો મેળવવા માટે હું નિઃસહાય થઈ જાઉં હું અથવા તો એમ કહું કે, આ પ્રશ્નોના જવાબ મને એટલા સરળ અને સહજ લાગે છે કે મને રમૂજ થાય છે!

“કોઈ પદ્ધી કઈ રીતે જોઈ શકે ?” બસ, તમે તેની તરફ નજર માંડો, તેની હજરીની નોંધ લેવા માંડો, કેટલું સરળ છે! જો કોઈ એમ પૂછે કે, તમે શા માટે પદ્ધીનિરીક્ષણ કરો છો, તો મારો જવાબ છે, “તેમાં મને આનંદ આવે છે” અને તમે પદ્ધીનિરીક્ષણ ક્યારે શરૂ કર્યું તો, “હમેશાંથી કરતો આવ્યો છું.” પદ્ધીઓ, માનવ-સમાજનો એક અંતર્ગત ભાગ છે અને પોતાનાં ઉલ્લાસ, ઉડાન અને ગાનથી તેમની તરફ સૌને આકર્ષિત કરે છે. તમે વિચારશો તો ઘ્યાલ આવશે કે, પ્રતેક વ્યક્તિ, પદ્ધીઓ કે કુદરતનાં અન્ય સુંદર સર્જનોથી ધીરે ધીરે એટલી ટેવાઈ જાય છે કે, તેમની નોંધ લેવાનું બંધ કરી દે છે. બાકી, દરેક બાળક પદ્ધીનિરીક્ષક છે, જીવ-જંતુંસર્ની છે, ભૂસ્તરશાસ્ત્રી છે! કોઈ બાળકને જંગલમાં લઈ-જાઓ અને પદ્ધી જુઓ ! તે તમને કોઈ નાની ઈધળ બતાવશે, અથવા તો રંગબેરંગી પથ્થરનો ટુકડો ઉપાડી ઝીસામાં મૂકશે.

મનુષ્યોની નાની આવૃત્તિસમાં આ બચ્ચાઓ નાની ખૂબીઓથી વધુ વકેર રહે છે, અને આ જ તો આપણો દ્રાષ્ટિભમ છે ! બાળકોનાં શરીર ભલે નાનાં હોય, વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, તેઓનાં મગજના કોષ અને જ્ઞાનતંત્રઓ, પૂર્ણ માત્રામાં હોય છે, જેમ આપણે મોટા થઈએ તેમ તે ગુમાવતા જઈએ છીએ ! એ રીતે બાળકો તેમની આસપાસની વસ્તુઓ માટે વધુ સજ્ઞાગ અને ઉત્કંઠિત હોય છે, તેઓ હલનયલન, રંગો અને ચમકની નોંધ લેતાં હોય છે. કરુણતા એ છે કે, પહેલાં માતાપિતા અને ત્યાર બાદ શિક્ષકો, તેમના આ કુતૂહલને દાખી દે છે, તેમનાં રસ-રૂખિને ચીલાચાલુ ઢાંચામાં નાખી દે

છે અને પદ્ધી જે ફળસ્વરૂપ રહે છે તે, બીજુ કાંઈ નહીં પણ ચોપાસ જોવા મળતી માણસની ચીલાચાલુ પાંચિક આવૃત્તિ ! મારી આ પત્ર-શ્રેષ્ઠીમાં, શિક્ષણ-ક્ષેત્રમાં પડેલા મારા અનેક મિત્રો, જેમને પ્રકૃતિનો મુખ્ય પરિચય કરાવવાનું સદ્ભાગ્ય મને સાંપર્યું તેવા હજારો યુવાન મિત્રો તથા જેઓ અત્યારે રસપૂર્વક શિબિર- મ્રવૃત્તિ કરી રહ્યા છે તે મિત્રોને, જે પદ્ધીનિરીક્ષણ મને ઘણું બધું આપ્યું છે તેના આનંદ વિષે જણાવવું છે.

મારા આ જ રસને લીધે હું ધર્મકુમારસિંહજી, સલીમ અલી, હુમાયું અબુલાલી, જન. વિલિયમ્સ, હોરેસ એલેસ્કેન્ડરી, પીટર સ્કોટ (જેમાનાં હવે કોઈ હયાત નથી !), ગુરદયાલસિંગ, જી. સી. ઉનિયલ વગેરે મારી પેઢીના સુંદર મહાનુભાવો સાથે નિકટના પરિચયમાં આવી શક્યો અને તેઓનો સહવાંસ કેળવી શક્યો. પદ્ધીઓ મને ડિમાલય અને તેથી પણ આગળ તિબેટ સુધી બેચી ગયા અને અને આજે તેમની વ્યાપક દુર્શાએ, તેઓના સંરક્ષણ માટેની જરૂરિયાતો અંગે મારી આંખો ખોલી નાખી છે.

હું જંગલખાતા દ્વારા થતા એક જ જીતિનાં વૃક્ષોના ઉછેર (monoculture)ની ટીકા કરું છું અથવા તો કુદરતી વાનસ્પતિક સંપત્તિને સાચવી તેનો ઉછેર કરવા માટે સૌને વિનવું છું તો તેનું કારણ એ છે કે, મેં જોયું છે કે, માનવસર્જિત પરિસ્થિતિઓમાં પદ્ધીઓ નથી ટકી શકતાં. આ પ્રશ્નો અંગે વધુ ઊડાણથી વિચારતા હું એ જાણી શક્યો કે, મનુષ્ય કેવી રીતે કુદરતી પ્રક્રિયાઓને વધુ મજબૂત કરી શકે. પદ્ધીઓમાંના મારા આ રસને લીધે જ હું સંજીવોની અદ્ભુત સહનશક્તિ તરફ વિશેષ જગ્યાત થયો અને સમજ કેળવી શક્યો કે, આપણો આ વિશાળ જનસમુદ્દર્ય ધારે તો નેસર્જિક સૌંદર્યને ફરીથી નિખારી શકે.

હું આ સંદેશ તમને સૌને પહોંચાડવા માંગું છું અને યુવાન મિત્રોને સમાજમાં પ્રવર્તતી બેઝિકરાઈ, પૂર્વગ્રહો તથા અનિષ્ટાનીય પ્રક્રિયાઓ જેવા પડકારો સામે કટિબંધ થવા આવકરું છું. આપણે જે પ્રકૃતિ સાથે મૂળથી જોયાપેલા છીએ તાં જ પાણ જઈને એ કાર્ય ઉપાડીએ તેના જેવું ઉત્તમ શું ?

ચાલો પક્ષીનિરીક્ષણ માટે જઈએ અને એ રીતે પ્રકૃતિના ખોળે પાછા! આમેય કુદરતથી દૂર તમે ક્યાં ભાગી શકવાના છો, મોહું ફેરવી લો તો પણ !

અને યુવાનો જ શા માટે ? દરેક વ્યક્તિ આવકાર્ય છે. ઊબંદુ, ઉમરલાપકને તો તેના પૌત્રસમ બાળકને પરતિયાની પાછળ પડતું જોઈ કે જમીન પર ઊબડા પડી કાચબાની આંખમાં આંખ મિલાવતું જોઈ કેટલો આનંદ થશે ! એટથે મારી આ સિંતેરથી થોડી વધારે ઉમરે હું પક્ષીઓને લિખે જે પણ શીખ્યો હું તે તમને સૌને વહેંચવાનો પ્રયત્ન કરીશ.

મેં પક્ષીનિરીક્ષણ એ જ રીતે ચાલુ કર્યું, જે રીતે દરેક નાનું બાળક કરે છે, જે કષે મારી શિશ્યાઓખે કુટુંબલવશ છતાં સભાનપણે તેને વેરી વળેલા વિશ્વને જોવા લાગી ત્યારથી. તે દિવસોમાં પક્ષીઓની સંખ્યા ઘણી વધારે હતી અને મેં જો તેની નોંધ ન લીધી હોત તો બુધ્ધિનો લક્ષ પાક્યો હોત ! ધૂમસભરી મારી સ્મૃતિમાં જાંખીને જોવાનો પ્રયત્ન કરું તો મને યાદ આવે છે કે, જ્યારથી સૂર્યોદય અને સૂર્યાસ્તનાં દૃશ્યો મારી જગૃત સમજશક્તિમાં અંડિત થયાં, જ્યારથી ઝતુફેર વિષે હું સજાગ બન્યો, ત્યારથી જ લગભગ મેં પક્ષીઓનો પરિચય કેળવ્યો છે. જે રીતે મંદિરનો ઘંટારવ,

મુલ્લાની બાંગ, ચોમાસુ બેસવાની ચાડી ખાતાં આંધી -તોફાન, ગ્રીઝના વાયરા અને આંખો, મારા જીવનનો અંતર્ગત ભાગ બની ગયા, તે જ રીતે આકાશમાં ઊરી રહેલી કુજાંકિત પણ મારી ચેતનાનો એક અંશ બની ગઈ.

અને ધરમાં માળો બાંધી અવરજવર કરતાં રહેતાં કબૂતર, ચકલાં અને મેના તો ખરાં જ. દરેક બાળક નોંધતું હશે કે, દોલાની બે જાત દેખાય છે અને અમુક ઝતુમાં માળામાંથી બચ્ચાં નીચે પડી જવાનું પ્રમાણ વધી જતું હોય છે. અને બાળક, ત્યારે કે આજે, એ નાના બચ્ચાને પોતાની પાસે રાખવાની ઈચ્છા રોકી શકશે નહીં. કદાચ, “તમે ક્યારથી પક્ષીનિરીક્ષણ થરુ કર્યું ?” નો જવાબ સામે બીજો પ્રશ્ન પૂછીને આપી શકાય, “તમે પક્ષીનિરીક્ષણ બંધ કર્યારે કર્યું ?” જ્યારે બાળક, શરીર રહેલી હવા જેટલું જ પક્ષીઓથી પણ વીટળાયેલું છે તો પછી પક્ષી નિરીક્ષકોની સંખ્યા આટલી ઓછી કેમ ? આ મુદ્દાનો પ્રશ્ન છે, ખાસ કરીને આજના સંજોગોમાં, જ્યારે પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે.

(ક્રમાંક)

૬૪૬, વાસ્તુનિર્માણ સોનાયલી, સેક્ટર-૨૨, ગાંધીનગર-૩૮૨૦૨૨



## નિરીક્ષણ નોંધ



ભાવનગરમાં પક્ષીનિરીક્ષણ

### \* પક્ષીઓનું આગમન

૧. ‘કાળિયાર રાખ્યેનું ઉદ્ઘાન’, વેળાવદરમાં તા. ૨૬-૮-૦૧ના રોજ વેળાવદરથી ભાવનગર આવતા હતા, ત્યારે અધેલાઈ પાસે લગભગ ૧૦૦ જેટલી કુજ ઝતુમાં પ્રથમ વખત જોઈ.

૩. ‘પીલ ગાઈન’ ખાતે ઢેંક બગલાઓનું ઓગષ્ઠમાં આગમન થયેલ છે.

### \* વધી જતી વસાહતો

૧. ચમચાઓ (Spoonbill)ની એક વસાહત સુભાષનગર, મંદિર પાસેના લીમડા ઉપર છે, જે જૂની

વસાહત છે. (તા. ૫-૮-૦૧)

૨. ચમચાઓની નવી વસાહતમાં (૧) રૂપાણી સર્કલ, દીવડી પાસે તથા (૨) રૂપાણી સર્કલ પાસે છે. બને લીમડા ઉપર જ છે. (તા. ૫-૮-૦૧)

૩. હું તથા શ્રી ઈન્ડ્રભાઈ ગઢવી તા. ૨૬-૮-૦૧ના રોજ વેળાવદર હતા ત્યારે, ચમચાઓની નવી વસાહત, રેલવે ડોસ્પિટલ, ભાવનગર ખાતે જોયેલી. તે પણ લીમડા ઉપર જ હતી.

### \* પક્ષીની ઉદ્વાની ઝડપ

તા. ૨૬-૮-૦૧, વેળાવદરથી ભાવનગર હું તથા ઈન્ડ્રભાઈ ગઢવી આવતા હતા ત્યારે, એક સફેદ કંકણસાર (White Ibis) ઉદ્વાની ઉદ્વાની સાથે થઈ ગઈ. અમારા વાહનની ઝડપ ૬૦ ક્રી. મી. હતી. લગભગ એકાં

## નિરીક્ષણ નોંધ

ક્રિલોમીટર સુધી સાથે ઊરી અને પછી બાજુમાં ઊડતી ઊડતી ચાલી ગઈ.

### દુઃખાંતસીંહ જાવા

એટ નંબર ૨૭૨૩-એક, ખવલ ટેનામેન્ટ્સ, સુભાગનગર, ભાવનગર.

\*\*\*



### સુરતમાં પક્ષીનિરીક્ષણ

તા. ૨૮-૮-૨૦૦૧ના રોજ દક્ષિણ ગુજરાત યુનિ.ના મેદાનમાં ચિયામાં કાળી પાનબગલી (Black Bittern) જોઈ. એ પછી ચારેક દિવસ પછી એ જ જગ્યાએ ફરી જોવા મળી.

તા. ૩-૭-૨૦૦૧ના રોજ કામરેજ તાલુકાના વાવ ગામે મારા મિત્ર ભરત પટેલના ખેતરમાં સરૂના જાડ પર નરી બગલા (Purple Heron)ના પાંચ માળા જોવા મળ્યા. એકમાં બચ્ચું મોટું હોવાથી દેખાતું હતું.



### બારડોલી માળાવસાહિત

બારડોલી શહેરમાં ‘પોલીસ સ્ટેશન’ની બાજુમાં આવેલી શાળાના ફળિયામાં ફાટીચાંચ ઢોક (Openbill Stork)ના લગભગ ૪૦૦ જેટલા માળા હતા. બચ્ચાં સાથે કુલ ૮૦૦ની આસપાસ પક્ષીઓ હશે. ત્યાંના સ્થાનિક વ્યક્તિઓ પાસેથી જીવનવા મળ્યું કે, ધ્રાં વરસોથી અહીં માળા કરી બચ્ચાં ઉછેરે છે. કોઈ રંગડતું નથી. બાજુના જ મકાનમાંથી ૧૦ ફૂટ નજીકથી જોઈ શકાય છે. (તા. ૨-૮-૨૦૦૧)



### કચ્છમાં ઘોરડ

તા. ૪-૮-૨૦૦૧ના રોજ કચ્છમાં, આર. એક. ઓ., શ્રી જીડેજ ના આમંત્રણથી હું, મારાં પત્ની, ‘નેચર કલબ’ના પ્રમુખ સ્નેહલભાઈ તથા સભ્યો નિર્મણાબેન અને દેવાણિખભાઈએ નાયિયાની મુલાકાત લીધી. લગભગ ૮ નર તથા ૩ માદા ઘોરડ જોવા મળ્યાં. બીજા દિવસે સવારે, ખડમોર અને અને ઘોરડ બને એક સાથે જોવા મળ્યાં અને અમે તેને કેમેરામાં કેદ કર્યી. એ સિવાય કાળા તેતર (Black Partridge) અને બદામી રજાગોધલા (Indian Sandgrouse) પણ ધણાં જોવા મળ્યાં. શ્રી જીડેજ નું કામ ઘણું સારું છે અને ઘોરડ અહીં સુરક્ષિત છે, એવું લાગ્યું.



### ગીરમાં નવરંગ

તા. ૩૧-૫-૦૧ના રોજ પક્ષીઓનો અવાજ રેકોર્ડ કરવા ‘નેચર કલબ’, સુરત તરફથી ગીર જવાનું થયું. ગીરમાં ચારે બાજુ નવરંગ (Indian Pitta)ના અવાજ સંભળાતા હતા. લગભગ ૨૦ થી ૨૫ જેટલાં જોવા મળ્યાં. એ સિવાય, શ્રી ભરતભાઈ પાઠકના માર્ગદર્શન ડેટન મોરબાજ (Crested Hawk Eagle) પણ જોવા મળ્યું.



### દાંગમાં કુહુકંઠ

ગુજરાતમાં દુલ્બ ગણતી ભારતીય કુહુકંઠ (Indian Cuckoo) દાંગમાં દર વર્ષે બે જગ્યાએ અચૂક જોવા મળે છે. વાસંદાના રાષ્ટ્રીય ઉથાનમાં સાદાદેવી ગામ પાસે, ‘રેલવે ટ્રેક’ની બાજુમાં અને વધઈ પાસે ‘બોટનીકલ ગાર્ડિન’ સામે, મે મહિનામાં અચૂક જોવા તથા સાંભળવા મળી જાય.

મુકેશ ભટ્ટ

આરસ-૧૦૧, ચીવીલાઈટ રોડ, સુરત-૩૮૪૦૦૭.

\*\*\*



### સાબરકાંઠા જિલ્લામાં ચિલોના

તા. ૧૭-૬-૨૦૦૧ના રોજ ધોળીવાવ કંપો (તા. વિશ્વનગર, જિ. સા. કા.) ખાતે પીપળાના વૃક્ષ ઉપર બે ચિલોના (Common Grey Hornbill) જોયા. તેના અવાજ ઉપરથી હાજરી જાણાઈ. તે બોલતા ત્યારે, દૂરથી મહુડા અને વડલા પરથી વારાફંટી જવાબ મળતો હોય તેવું લાગ્યું. આમ તે વિસ્તારમાં ચારથી પાંચ પક્ષીઓ હશે તેમ. માની શકાય.



### બાકોરમાં નવરંગ (Indian Pitta)

૨૬-૨૭-૨૮, મે ૨૦૦૧ના રોજ બાકોર (જિ. પંચમહાલ), સુંદરવનમાં માત્ર દસ ફૂટ દૂરથી નવરંગ જોયું. તે આખો દિવસ અહીં જ રહેતું હતું તથા જમીન ઉપરથી જીવ-જંતુ શોધીને ખાતું હતું. અમે તેને ખરાઈને જોયું, તેના શરીર ઉપરના રંગ, ચાંચનો આકાર, પીછાનું તથા રંગનું વિભાજન, ખોરાક ખાવાની પણ્ણતિ, થોડી વારે ટંકાર થઈને ઊંચું જોવાની ચેષ્ટા, ફૂદકા મારતી ચાલ વગેરે ખૂબ માણ્યું. મારી સાથે નિર્મણાબેન ચાથોથ તથા હેમાક્ષીબેન બારડોલિયા હતાં.

આ ઉપરાંત સુંદરવનમાં અધરંગ (Tickell's Blue Flycatcher), નાચણ (Whitebrowed Fantail Flycatcher),

## નિરીક્ષણ નોંધ

વલેડી (Rufousbellied Babbler), પીળીઆંખ વલેડી (Yelloweyed Babbler), હરિપણ (Green Pigeon), મોટો પોપટ (Alexandrine Parakeet), સિરકીર કુકૂ (Sirkeer Cuckoo), રંગીન બટાવડા (Painted Sandgrouse) - ૩, રાખોડીપગ બિલબટેર (Common Bustard Quail) - ૬ વગેરે પક્ષીઓ જોયા.

### મૃગ-ઉદ્ધવિ

મહાવીર નગર, વિજયનગર (ક્રિ. સા. ક્ર.) - ૩૮૨ ૪૬૦

\*\*\*



### કચ્છમાં પક્ષીનિરીક્ષણ

\* તા. ૨-૬-૨૦૦૧ના રોજ નિગાળ તળાવ (તા. અંજાર)ની મુલાકાત લીધી. ત્યાં પીળીઆંખ ટૉક (Painted Stork)ની માણાવસાહત જોઈ. અહીં તળાવમાં આવેલા દેશી બાવળ પર લગભગ ૧૦૦ માણા હતા. અમુકમાં બચ્ચાઓ હતાં, અમુકમાં ઠીડાં સેવવાનું ચાલુ હતું. અહીં ૧૫૦ પુષ્ટ પક્ષીઓ જોયા.

અમારા વિસ્તારમાં અલાભ્ય એવો ૧ સોનેરી પીળક (નર) (Golden Oriole) જોયો. નિગાળ તળાવમાં ઝતુની મારી પ્રથમ ધોળી વાબગલી (Gull-billed Tern) જોઈ. રતનાલ-નિગાળ વચ્ચે ઝતુનો મારો પ્રથમ મોટો કાબરો પિદો (Pied Chat) જોયો.

\* તા. ૮-૬-૨૦૦૧ના રોજ દેવીસર તળાવ (તા. ભુજ) નજીક ૬ મોટાં પતરંગા (Bluecheeked Bee-eater) તથા એક કાશ્મીરી ચાખ (European Roller) જોયો. તે જ દિવસે સાંજે વાંદ ડેમ (Vandh Dam, તા. ભુજ) ખાતે એક માણાવસાહત જોઈ. તેમાં ૪૦૦ માણા હતા. આમાં સર્પ્રીવ (Darter), રાતબગલો (Night Heron), નાનો બંગલો (Little Egret), ઢોર બગલો (Cattle Egret), વગેરે ઝતિનાં પક્ષીઓના માણા હતા. લગભગ બધાં પક્ષીઓનાં બચ્ચાં મોટાં થઈ ગયા હતાં. જંગલખાતાના શિવરાજ ગઢવીએ આ જગ્યાની પ્રથમ માહિતી આપી હતી. અહીં ઝતુનો મારો પ્રથમ ટિવાળી માખીમાર (Spotted Flycatcher) જોયો.

\* તા. ૮-૬-૨૦૦૧ના રોજ ભીમસર તળાવ (તા. નખત્રાણ) ગયા હતા. ત્યાં ચમચા (Spoonbill) ના ૫-૬ માણા જોયા. ઠીડાં સેવવાનું ચાલુ હતું. અહીં ઝતુની મારી પ્રથમ પાનપક્ષી (Marsh Harrier) જોઈ.

\* તા. ૧૫, ૧૬-૬-૨૦૦૧ દરમિયાન જંગલખાતા તરફથી નણીયા પાસેના 'કચ્છ ધોરડ અભયારણી' (તા. અબડાસા) ખાતે ધોરડની ગણતરી થઈ. હું તા. ૧૬-૬-૨૦૦૧ના રોજ અહીં ગયો હતો. તે દિવસે મેં ૪ ધોરડ (Great Indian Bustard) જોયાં. વળી, અહીં એક ખડમોર (Lesser Florican)નો માળો જોયો. તેમાં માદા ઠીડાં સેવતી હતી. પાંચ ઠીડાં હતાં. માળો જંગલખાતાના કર્મચારીએ શોધ્યો હતો. અહીં એક લરજ પણ (Kestrel) જોઈ.

\* તા. ૨૦-૬-૨૦૦૧ના રોજ અંજાર પાસે, પ્રથમ કુજ (Common Crane) દની સંખ્યામાં જોઈ. સુરખારીની ખાડીમાં ૫૦૦ + ટિલીયા (Ruff-Reeve) જોયા.

\* તા. ૩૦-૬-૨૦૦૧ના રોજ દેવીસર તળાવ ઉપરના પક્ષીનિરીક્ષણમાં મહાત્વની બાબત એ હતી કે, ખૂબાં જ ઊંચાઈ પર અમે ૩૦-૩૫ મોટા પતરંગા (Bluecheeked Bee-eater) ઉડતાં જોયાં, જે આગળ પ્રવાસમાં જતાં હોય તેમ લાગ્યું.

\* તા. ૭-૧૦-૨૦૦૧ના રોજ 'વર્લ્ડ બર્ડવોચ'ના ઉપકરે અમે ઢોસા તળાવ (ભુજથી ૧૫ કિ.મી.દૂર) પર પક્ષીનિરીક્ષણનો કાર્યક્રમ રાખ્યો હતો. આમાં મારા સહિત, અસ્થિન પોમલ, જયસિંહ પરમાર, નવીન બાપટ તથા ઈશ્વાલીમ દરવાડિયાએ ભાગ લીધો હતો. અહીં ૩૨ ઝતનાં પક્ષીઓ જોયાં. તેમાં નોંધનીય આ ગ્રમાણો હતાં.

મોટી ચોટીલી ઝૂલ્કી (Greatcrested Grebe) -૨, નાની શિયાળુ ઝૂલ્કી (Blacknecked Grebe) -૧, મોટા પતરંગા (Bluecheeked Bee-eater) -૫, ગણણો (Shoveller)-૮, વગેરે.

\* તા. ૧૪-૧૦-૨૦૦૧ના રોજ સુરખારીની ખાડીમાં ૪૦ દંજ (Flamingo) જોયાં. માળિયા-જામનગર વચ્ચે બસની મુસાફરી કરતાં કુલ ૮ કાશ્મીરી ચાખ (Kashmir Roller) જોયા.

શાંતિલાલ વડુ

કૂના વાસ, માંદિરવાળી ખાંચો, માધાપર, ભુજ-૩૬૦૦૨૦

\*\*\*

## નિર્ક્રિકાણ નોંધ



### કિલેશ્વરમાં માળાવસાહત

હમણાં (૧૭-૧૦-૦૧નો પત્ર) કિલેશ્વર(બરડા)

જવાનું થયું. કિલેશ્વરની પ્રાકૃતિક સંપદા ગાઢ બની છે. વૃક્ષારોપણ જેવી જગ્યાત પ્રવૃત્તિ તથા સંરક્ષણથી વૃક્ષો ગીય થયાં છે. આઠ વર્ષ પહેલાનું કિલેશ્વર અને આજનું કિલેશ્વર બે જુદા જ ચેરા નજરે પડ્યા. ત્યાં એક 'રાવણ વૃક્ષ' ઉપર નાના બગલા (Little Egret)-ની માળાવસાહત નજરે પડી.

એ જ રીતે, જામજોધપુર મુકામે, તાલુકા પંચાયત, ચાયાલય તથા સરકારી આરામઘૂંહના માંગણમાં જે વૃક્ષો છે, તેમાં નાના બગલા (Little Egret) તથા ઢોર બગલા (Cattle Egret)-ની માળાવસાહત જોઈ. આ માળાવસાહત રસ્તા ઉપર, ભરચુક વિસ્તારમાં છે. આસપાસમાં ક્રાંત્ય પાણીનો ઓત નથી, તે આશ્વર્યની વાત છે.

ઓક્ટોબરમાં મારા, જામનગરથી મોટી પાનેલીના પ્રવાસ દરમયાન હિવાળીધોડા (White Wagtail), કાશ્મીરી ચાખ (Kashmir Roller) તથા વૈયાં વગેરે પ્રવાસી પક્ષીઓ જોયાં. કાશ્મીરી ચાખ અમુક અંતરે વીજળીના તાર પર બેઠલા જોયા. વૈયાં (Rosy Pastor) નાં તો ટોળેટોણાં સૌરાષ્ટ્રની ભૂમિ પર પહોંચી ગયાં છે. (અવલોકનની તારીખ, પક્ષી, માળાની સંખ્યા તથા વૃક્ષોની સંખ્યા અને પ્રકાર વગેરે માહિતી ઉપયોગી થાય - સ.)

### મનીષ જાલવાડિયા

બ્લોક નં ૭/૪, સરકારી વસાહત (બેઠચર), મુ. બેઠી, જિ. જામનગર-૩૬૦૦૮

\*\*\*



### ટિટોડી જેવું, પણ ટિટોડી નહીં

તા. ૨૫-૩-૨૦૦૧ના રોજ વડોદરાના વાધોડિયા તાલુકામાં આવેલા ગોરજ ગામ-તળાવ ખાતે પક્ષીનિરીક્ષણ માટે ગયા હતા. ત્યાં ગજપાંવ (Blackwinged Stilt) -૩૦ થી ૩૫, તુતવારી (Common Sandpiper) -૨૧, રાતપગ (Redshank) -૧૨, ટિટોડી (Redwattled Lapwing) - ૩૫ થી ૪૦, વગેરે પક્ષીઓ જોયા.

ટિટોડીના ઝૂંઝુંમાં સાવ અલગ તરી આવતું પક્ષી દેખાયું. ટિટોડીના જ કદનું, ટિટોડી જેવી ચાંચ, પગ, આંખની કીસી. માત્ર શરીર ઉપરનો રંગ જુદી હતો, માથા પરનો ભાગ કાળો, પીઠ તથા પેટનો ભાગ સફેદ અને પગ પીળા. દૂરબીનથી સ્પષ્ટ જોઈ શકાય તેમ હતું. અમે ધીમા પગે પક્ષીની નજીક

જવાનો પ્રયત્ન કર્યો. અમારી પાસે 'જૂમ લેન્સ' ન હતો, પણ સાદા 'લેન્સ'થી તસવીર લીધી છે, જે આપને ઓળખ માટે મોકલું છું.

(તમારા પક્ષીના વર્ણન તથા તસવીરને આધારે એવું લાગે છે કે, આ પક્ષી રંગક્ષોની ખામીયુક્ત ટિટોડી હોઈ શકે. જો આંખની કીસી લાલ ન હોય તો, 'વિંલગ' સંણગ અંક ૧૪માં પૂછ ૨૬ ઉપર આવેલી મ.કુ. ડિમતસિંહશની 'વિવર્ણ પક્ષીઓ' અંગેની નોંધના આધારે 'colour mutation' નો નમૂનો કહી શકાય - સ.)

અનિલ ગોહિલ, કાર્તિક ઉપાધ્યા  
એ-૮, સુષી ફેલ્ડ્સ, સૂર્યદર્શન ટાઉનશીપ સામે, માંજલપુર, વડોદરા

\*\*\*



### વિઘસંતોષી ચકલીઓ!

આજે સવારે જ એક ઘટના જોઈ એટલે અત્યારે જ લખવા બેસી ગયો છું. ટપૂસિયા(Whitethroated Munia)-ની એક જોડીને જોઈ, જે જમીન ઉપરથી તણખલાં, પાતળી દોરી જેવી સાંઠકડીઓ લાવીને મારા ઘરની સામે વીજળીના થાંખલાંમાં સૌથી ઉપર ગોઢવતી હતી. થોડું કાંઈક લેણું થયું અને ચકલીઓએ આવીને માળો પીંખી નાંખ્યો. ટપૂસિયાએ ફરી મહેનત કરી અને ફરી એ જ ઘટનાનું મુનરાવત્તન થયું. નજીકમાં ચકલીઓના ચાર માળા હતા પણ આપાંથી એક જોડીને જ ટપૂસિયાના માળામાં વિશેષ રસ હતો. છેવટે ટપૂસિયા જ્યાં છોડીને જતાં રહ્યા.



### પોળો પાસે કાબરી રામચકલી

(Whitewinged Black Tit)

વિજયનગર (જિ.સા.કા.) પાસે 'જોડનું જંગલ' એવો વિસ્તાર છે. આ વિસ્તારમાં સાગ, સાદડ, ટીમરુ, દૂધલો, પારિજાત તથા નીલગિરિના વૃક્ષો છે. વનવિભાગના 'વનીકરણ સેટ્ર'ની ફરતે ઘાસ છે. વનવિભાગ તેને 'જલાઉ લાકડા' તથા ઘાસચારાના 'ખોટ' તરીકે ઓળખાવે છે. એક જમાનામાં અહીં ગીય જંગલ હતું.

આ વિસ્તારમાં તા. ૨૨ ઓગષ્ટ ૨૦૦૧ના રોજ સાંજે ૫-૩૦ વાગ્યે સાગના જાડ પર કાબરી રામચકલી જોવા મળી. શરૂઆતમાં બે દેખાઈ. એક ઊડીને દૂર ગઈ, બીજી અમે (મારી સાથે સુરતના વિરલ પ્રજીપતિ હતા.) ધ્યાનથી જોઈ. તેના કાળા અને સરેદ રંગના સંયોજનને લીધે તેની હાજરી

## નિર્વીકણા ઠોડા

આંખે ઉડીને વળગે છે. આ જ સ્થળે, ૨૩-૮-૦૧ના રોજ સાંજે ૪ થી પના સમયગાળામાં દેખાઈ.

(કાબરી રામચકલીના દેશવ્યાપી સર્વેકષણમાં તથા હાલમાં ગ્રાસ્ય પુસ્તકોમાં સાબરકંઠાના આ વિસ્તારમાં આ જાતિનો વ્યાપ દર્શાવેલો નથી, તે જોતાં મધુરભાઈની આ નોંધ ખૂબ જ મહત્વની કહેવાય. ‘વિંગ’ના પહેલાંના અંકોમાં પણ તેમની આ પક્ષીની અવલોકન નોંધ આવી ગઈ છે.- સ.)

મૂલ્ય-ઉદ્ધૃતિ

મહાવીર નગર, વિશ્વનગર (ક્ર. સા. કી.) -૩૮૩૪૬૦

\* \* \*



### મારી ડાંગની મુલાકાત

૨૧મી નવે. '૦૧ના રોજ કેવડિયાથી ડાંગ જતાં, માંડવી પાસે, તાપી ઉપરના પુલ ઉપર ગાડી ઊભી રાખી થોડું પક્ષીનિરીક્ષણ કર્યું. નહીના પટમાં ૭૦ થી ૧૦૦ જેટલી પ્રાણીઓ બતક જોઈ. હીછા પાણીમાં શેવળ ખૂબ ફેલાયો છે, એટલે પ્રાણીઓ માટે પૂરતો ખોરાક ગ્રાસ્ય છે. આટલી મોટી સંઘામાં આ મોટી બતક, સાધારણ રીતે જોવા મળતી નથી.

તે દિવસે બપોરે ‘સુરત પ્રકૃતિમંડળ’ના આમંત્રણને માન આપી હું તેઓના શિબિરમાં હાજરી આપવા પહોંચ્યો. નિર્મળા તથા કર્મવીર સાથે સમય મળે પક્ષીઓ નિહાળવા ગયો. શિબિરનો પડાવ પૂર્ણ નહીને કાંઈ હતો. ખૂબ મોટા વાંસનાં વૂભડાઓ અને ઊચા વૃક્ષોમાં પક્ષીઓ જોવાનું મુશ્કેલ હતાં. તેઓના અવાજો ખૂબ જનિક્ષિયક હતા. માનીએ તેટલા પ્રમાણમાં પક્ષીઓ ન હતાં, છતાં, છૂટાછવાયાં આવાં જંગલોમાં હોય તેવી બધી જાતો, બલે દેખાઈ નહીં, સંભળાઈ બરી.

ડાંગ અને રાજીવિપળાનાં જંગલોમાં Black and Orange Flycatcher જોવાના અલગ અહેવાલો, મજ્યા છે. જો તેમ હોય તો ખેખપર આનંદની વાત છે, પણ કોઈ નવા પક્ષીની હાજરી પૂરાય તે પહેલાં થોડી સાપચેતી રાખવી, તે પર હું કાયમ ટકોર કર્યા કરું છું. કંયું પક્ષી આ ખૂલામણીમાં નાખે છે તે અંગે હું કાયમ વિચાર કરતો. એક ઊચા વૃક્ષ ઉપર થાપ આપી જાય તેવું પક્ષી જોયું. કર્મવીરને બતાવ્યું. કેસરી પૂછ્યી અને ટોચની ડાલો ઉપર માખીમારની જેમ જીવાં પકડતું હતું. સ્નેહલે મારા માટે એક સુંદર દૂરભીન મોકલ્યું હતું, જેમાંથી નજર કરી તો થરથરા (Black Red-

start) ની પૂછું-ખૂજારી જોઈ. થરથરાની માદા હતી. નર હોત તો ગીય ઝડીમાં ખૂબ થવાનો સંભવ ખરો.

નિર્મળાએ મારું ધ્યાન એક ચટકી માખીમાર (Redbreasted Flycatcher, Ficedula parva) તરફ દોર્યું. ખૂબ નજીક અને સારી રીતે નિદ્ધાર્યો. આ પક્ષી, ચટકી માખીમારની માદાથી જરા જુદું લાગ્યું. કંદ થોડું મોઢું અને શરીરનો રંગ વધુ વેરો હતો. મને તેનો અવાજ પણ, ખૂબ જ પરિચિત ચટકી માખીમારની સરખામણીમાં અલગ લાગ્યો. નિર્મળાએ જાણ કરી કે તેણીએ એક બે નર જોયેલ જેના ગણા અને છાતી પરનો લાલ રંગ ખૂબ જ વેરો હતો. બીજી દિવસે સવારે આ જ પક્ષીએ મારી સાથે વાંસના વૂભડામાં સંતાક્ષકી રમવાનું ચાલુ કર્યું. મેં તેના અવાજની નોંધ કરી, “પરરર... ચિપ-ચિપ-ચિપ...” વધારે વ્યાપક અને મારો ખૂબ જ પરિચિત ચટકી માખીમાર, “૨૨.૨૨.૨૨” અને વચ્ચે, “પીયું, પીયું, પીયું” જેવા અવાજો કાઢે છે. મારી પાસે કીસ કાશમીરસર્કારનું નવું પ્રકાશિત પુસ્તક હતું, જેમાં આ અવાજ કાશમીર માખીમાર (Kashmir Flycatcher, Ficedula subrubra) કરે છે, તેવો ઉલ્લેખ વાંચ્યો! આ પક્ષી, કાશમીરમાં એક નાના વિસ્તારમાં પ્રજનન કરે છે અને શિયાળો શ્રીલંકાના પર્વતોમાં ગાળે છે. પશ્ચિમધારનાં ચિરિંગલોમાં તેની છૂટીછવાથી નોંધના અહેવાલો છે, તો ડાંગમાં શા માટે નહીં? હોઈ શકે, પણ જ્યાં સુધી નર જોવા ન મળે ત્યાં સુધી, આ નવા પક્ષીની વરણી મારી અંગત પક્ષી-સૂચિ અને ગુજરાતની પક્ષી-સૂચિમાં ન થઈ શકે. મારા યુવાન મિત્રોએ આ કોકું ઉકેલવાનું રહ્યું.

ડાંગથી પાછા ફરતાં ૨૬મી નવે. '૦૧ના રોજ રાતવાસો સુરતની બહાર એક વાતીમાં કર્યો. બારોલોલીથી સુરતનો આખો વિસ્તાર શેરી અને કેળાના ઉત્પાદન માટે વપરાય છે. જંતુનાશક દવાઓ અને કૃત્રિમ ખાતરોનો બહોળો ઉપયોગ થાય છે. આને કારણે, જીવાં ખાતાં નાનાં પક્ષીઓનો અભાવ જણાયો, પરંતુ સિપાઈ ખૂલખુલ (Redwhiskered Bulbul)ની સંખ્યા મોટી હતી. સુરતના મિત્રોએ દશિંશ ગુજરાતમાં આપણાં સ્થાનિક પક્ષીઓ ઉપર વધારે નજર આપવી. સાથે સાથે, પક્ષીઓને આકર્ષ તેવાં ફલ- ફૂળવાળાં વૃક્ષોનું મોટા પાયે વાવેતર તથા ઉંઘેર કરવો.

લવકુમાર ખાચર

ગાંધીનગર

\* \* \*

 ત્રાજ... નારદા... પરિચેજ..

'વિહંગ'નું નવું સ્વરૂપ ખૂબ જ ગમ્યું. ૩૧-૧૦-૦૧ ના રોજ નણસરોવર - બગોદરા - તારાપુર - પરિઅનેજ - ખેડાના રસ્તા ઉપર સહાયક વન સંરક્ષકશ્રીઓના તાલિમાથીઓ સાથે જરૂરી અમણ કર્યું એ દરમિયાન....

→ પરિઅનેજમાં ખૂબ જ ઓદૃષ્ટ પાણી હતું. ૨૫૦-૩૦૦ જેટલાં મોટા હજ, ૭૦૦-૮૦૦ જેટલી બતકો અને ઉપરાંત શૈતપાંખ જલમાંજર (Pheasant-tailed) સહિતના અન્ય સામાન્ય જોવા મળીનાં પદ્ધીઓ જોયાં.

→ વહાણવટી માતાના મંહિર પાસે સારસનું એક બચ્ચું જોયું. એ સ્થિતિએ આખા રસ્તે એક ઘડ સ્ટર્ટ જોવા મળેલ નઈ.

→ શેખુપુર ગામના પાટિયા પાસે, રસ્તા ઉપર જ આવેલા એ મોટા લીમડાઓ ઉપર માળાવસાહતો થયેલી છે. ઘણાના માળા પૂરા થયા હોવા હતાં નાના કાંજિયા (Little Cormorant), ઢોર બગલા (Cattle Egret) અને નાના બગલા (Little Egret) ના મોરી સંખ્યામાં માળાઓ ચાલુ હતાં. લગભગ દરેકમાં બચ્ચાં હતાં. સહેજ અંદાજ મુજબ, બધા મળીને ૩૦૦થી ૪૦૦ માળાઓ તો હતો જ. સ્થાનિક માણસના જણાવ્યા અનુસાર, છેલ્લાં ૫-૭ વર્ષથી દર વર્ષ તાં માળાઓ થાય છે. ગામલોકોને બહુ ગમતું નથી પણ, "પક્ષીઓને ના થોડી કદેવાય છે? ભલે બિચારાં રહે", એ ન્યાયે સાચ્યે છે. પક્ષીઓનો કલબલાટ અને ચારકની ગંધ થોડો અણગમો કરે છે તેમ લાગ્યું. પણ ભાવુના-લાગડી હોવાથી બીજી કોઈ ખલેલ ગામલોકો તરફથી નથી.

→ લગભગ તમામ તળાવડાંઓ મહીમાંથી પાણી ન છોડાવાના કરણે ખાલી જેવાં છે, ઓછાં પાણીવાળાં છે. નારદા અગાઉના નિરીક્ષણોની સરખામણીને ફીકું અને મૃતપ્રાય લાગ્યું. આખા તળાવ ઉપર નળીવેલ (?) (Ipomea aquatica), કમળ (Nelumbium), પોયડા (Nymphaea), ધા બાજરિયા (Typha) તથા ગાંડીવેલ (Ipomea Carnea) ના કારણે ખુલ્લો જળવિસ્તાર છે જ નઈ.

→ ત્રાજના તળાવની વચ્ચેના ટાપુ ઉપર ૪-૫ વૃક્ષો પર સુંદર માળાવસાહત હતી. તેમાં સંક્રદંશ કાંકણસાર(White Ibis), ફાટીથાંચ ઢોક(Openbill Stork), નાના કાંજિયા (Little Cormorant) અને બગલા (Cattle and Little

Egrets) હતાં. સરેરાશ ઔદ્ધોદાને તો બધા મળીને ૨૦૦-૨૫૦ માળાઓ તો ઓછામાં ઓછા હતે. અલબત્ત આ ખૂબ જ આછો અંદાજ છે. આ તળાવમાં ગયા નહીં ને અગાઉના વર્ષમાં ઊંડાણ કરેલ હોવાના કારણે જલદુલી (Eichornia) લગભગ ગેરહાજર હતી, જે સારી નિશાની ગણી શકાય.

→ નણસરોવરમાં ભગતડાં (Coot) પદી બીજા નંબરે પિયાસણ (Wigeon) કદાચ હોય તેમ લાગ્યું. ખૂબ જ સારી સંખ્યામાં જોવા મળી. સરોવરમાં તેમજ નણસરોવરથી બગોદરા સુધીમાં અગાઉનાં વર્ષોની સરખામણીને ખૂબ જ વધુ સંખ્યામાં મોટા પતર્ગા (Bluecheeked Bee-eater) જોવા મળ્યા. તેની સંખ્યા વધવાનું કારણ સમજાતું નથી.

→ ગયા મહિને ભાવનગર હતો ત્યારે (૧૮-૨૦ ઓક્ટોબર આસપાસ) શ્રી મોહિતભાઈ તથા નવનીતભાઈ સાથે વિમાનધરથી નવા બંદર પરના રસ્તા ઉપરના તળાવમાં ૬૦-૭૦ કરકરા (Demoiselle Crane) બેઠેલા હતા અને પાણીની વચ્ચમાં બે ફૂતરાઓએ એક કરકરાને પકડ્યો હતો તે જોયું. કરકરાએ ખૂબ જ લાંબા સમય સુધી તરફણ્યા માર્યા હતાં અને અમે ત્યાં ૨૦-૨૫ મિનીટ હતા ત્યાં સુધી એ મર્યાન હતો, પણ મરવાની અણી ઉપર હતો. પાંખ તૂટી ગઈ હતી, પગ તૂટી ગયો હતો. ફૂતરા કરકરા નો શિકાર કરે એ મારા જોવામાં પહેલી વાર આવ્યું.

૬૬૪ વોરા

૧૬૮, સ્વિટલ્ટન એપાર્ટ., સેક્ટર-૨૮, ગાંધીનગર-૩૮૨૦૨૮

\*\*\*



પંચમહાલમાં હરિતભાલ હરેવો

ગોધરા વનવિભાગમાં સહાયક સંરક્ષકશ્રી તરીકે ફરજ બજાવતા શ્રી અંજ્ય જૈને તેઓએ ઘોંધબા તાલુકાના ઝંગલવિસ્તારમાં હરેવો જોવા બાબતે જાણ કરતાં મને નવાઈ લાગી. મેં અગાઉ માંડવી- ઉમરપાડા વિ. ઝંગલવિસ્તારમાં બને હરેવા, હરિતભાલ હરેવો તથા સોનેરીભાલ હરેવો (Goldmantled Chloropsis, Goldfronted Chloropsis) જોવા હતા, પરંતુ પંચમહાલમાં જોયા ન હતા. પક્ષીવિદુસલીમઅલીની 'Birds of India'માં સમગ્ર ભારતમાં હરિતભાલ હરેવા જોવા મળે છે તે જાણ્યું.

તા. ૧૬-૨-૨૦૦૧ના રોજ સવારે મારા

## નિરીક્ષણ નોંધ

ક્વાર્ટર્સના ફળિયામાં હું બેઠો હતો, ત્યારે વારંવાર કાળિયા કોશી (Black Drongo)નો અવાજ આવતા મેં અરીઠાના વૃક્ષની અંદર દૂરભીન તાકયું. આશ્વર્યસહ, હરિતભાલ હરેવો જોવા મળેલ. અવાજ તદ્દન કાળિયા કોશી જેવો જ જજાતો હતો. લગભગ અડધો કલાક સુધી નિરીક્ષણ કરવા મળેલ. મા. શ્રી લાલસિંહજી રાઓલના 'વન-ઉપવનનાં પંખી'માં જોતાં આ પ્રમાણે જજાવેલું છે. "બેમાંથી સોનેરીભાલ હરેવો દક્ષિણ ગુજરાતમાં તાપીથી ઉત્તરે નથી નોંધાયો, જ્યારે હરિતભાલ હરેવો તેનાથી થોડો આગળ વધી દક્ષિણ ગુજરાતમાં નર્મદા સુધી પહોંચો છે. એક વાર પંચમહાલ જિ.ના રતનમાળ જંગલવિસ્તારમાં હરેવો જોયેલ, પણ તે સોનેરીભાલ હતો કે બીજો, તેની ચોકસાઈ થઈ શકેલ નહીં." હરિતભાલ હરેવો, ગોધરા ખાતેના વનવિભાગની કોલોનીના પ્રાંગણમાં જોવા મળતાં સાનંદાશ્ર્ય પામેલ. અહીં, બાજુમાં અન્ય જિલ્લાકાણના અવિકારીઓના બંગલા આવેલા છે, તેમજ દરેક ફળિયામાં મોરાં વૃક્ષો સારા પ્રમાણમાં છે, જેથી હરિતભાલ હરેવો જોવા મળી શકે તેમ માનેલ.

ત્યાર બાદ, તા. ૨૨-૮-૨૦૦૧ના રોજ ગોધરા તાલુકાના અછાલા જંગલ ખાતે મારા જંગલફેરણમાં હતો ત્યારે, બહેડાના વૃક્ષની ઘટામાં દ્વલનચળન જોતાં તેમજ પક્ષીનો અવાજ આવતાં દૂરભીન માંડયું તો હરિતભાલ હરેવો જોવા મળેલ. તા. ૧-૮-૨૦૦૧ના રોજ અછાલાના જંગલ-વિસ્તારમાં ફરી વાર હરિતભાલ હરેવો જોવા મળેલ.

સુનીલ કે. પુણુઃ

એજ ફોરેસ્ટ એપોક્સિમર, ફોરેસ્ટ કોલોની, જમબાના સાથે, ગોધરા-૩૮૮૦૦૧

\* \* \*



**પીળી પાનબગલી (Yellow Bittern)**નું પ્રજનન

શાજકોટ નજીકના આણું-૨ જળાશયની ડેઢવાસની નદીમાં પાઠ્યપ ગળવાને લીધી ચોમાસા પહેલાથી છૂટા-છવાયા ચિયા ઉગેલા. તા. ૩૦-૭-૦૧ના રોજ આ ચિયામાં માળા બનાવેલ પાન-સુગરીઓ (Blackthroated Weaver)ની તસવીર ઉતારવા હું અને શ્રી ભૂખણ પડ્યા ગોઠણ-સમાઝાં પાછીમાં ફરતા હતા. ભૂખણભાઈ એક જગ્યાએ માળો બનાવતી પાન-સુગરી રેસા લઈ પરત આવે તેની તસવીર લેવા માટે સ્થિર બેસી રાહ જોતા હતા. અવલોકન કરતા અચાનક મારું ધ્યાન, નજીક ચિયાનાં ઝૂડમાં, સુકાયેલા ચિયાની આડી છાજલી (platform) પર પડ્યું અને પાન-

બગલીનો માળો હોવા વિશે શંકા ગઈ. દૂરભીનથી ચકસતા પાન વચ્ચે એક તગતગતી પીળી આંખ જોઈ ખુશીથી ઊછળી પડ્યો! અમોને જોઈ પીળી પાનબગલી માળા પર "on guard"ની સ્થિતિમાં, આકાશ તરફ ડોક અને લંબાવી સ્થિર (freeze) થયેલ હતી. તેની ડોક ચાંચ ચિયાને સમાંતર હોતાં, તે ચિયા સાથે એકદમ ગોપન (camouflage) થઈ ગઈ હતી. માળો તપાસતા તેમાં ચાર સંકેદ હુડાં હતાં. માળો પાકીની સપાટીથી ૨.૫ ફૂટ ઊંચો, ઘાસની પર્દીને તોડી, ઉગેલાં ઘાસ (ચિયા) સાથે ગૂંધી, છીછરી ટોપલી જેવો બનાવાયેલો હતો. આ માળાની નજીક, ઊંચે એક પાન- સુગરીનો, ત્યજાયેલો, અધૂરો બનાવેલ માળો હતો. અગાઉની નોંધ તપાસતા, તા. ૨૫-૮-૧૯૮૬નાં રોજ ડો. તેજ મુંડકૂર સાથે પીળી પાનબગલીનો માળો ન્યારી-૧ તેમ નીચેનાં ચિયામાં જોયેલ. તેમાં પ હુડાં હતા અને માળો પાનસુગરીનાં અધૂરા ત્યજાયેલા માળા પાસે બનાવેલ હતો. પરંતુ ત્યાર બાદ, આસપાસના ચિયા કોઈ કાપી જતાં માળાનો નાશ થયો અને પ્રજનન નિષ્ફળ ગયેલ.

તા. ૩-૮-૦૧ના રોજ ફરી મુલાકાત વેતા, પીળી પાનબગલી હુડાં પર બેઠેલ હતી. ઘણાં વર્ષો બાદ, પાનબગલીનું પ્રજનન નોંધેલ હોવાથી વધુ વિક્ષેપ ન કરતાં, ફરી તા. ૧૮-૮-૦૧ના અમો તેનો માળો દૂરભીનથી ચકસવા ગયાં. દૂરથી દૂરભીન વે જોતાં, માળાનાં મધ્યમ ઊછરેલાં ત બચ્યાં તેમજ ૧ હુડું દેખાયા. આ દિવસો દરમિયાન ખાસ્સો વરસાદ થયેલ હતો. માળાની ઉપરના ચિયા અંદર તરફ વાળી બચ્યાંને વરસાદથી રક્ષણ આપવા માટે છત્રી જેવું બનાવેલ હતું.

દસેક દિવસ બાદ માળો ખાલી હતો અને પાન-બગલી કે બચ્યાં નજરે ન ચહ્યાં. તેમના સફળ પ્રજનનનો આનંદ થયો.

 રાજકોટમાં પ્રથમ વાર શ્યામશિર મુનિયાના પ્રજનનની નોંધ

તા. ૩૦-૭-૦૧ના રોજ આણું-૨ તેમ નીચે જતાં દૂર ચિયામાં શ્યામશિર મુનિયા (Blackheaded Munia)ને ઉડાઉિડ કરતાં, ચિયામાં ધૂસતાં જોયાં. સાથે ટપૂસિયા (Whitethroated Munia)ને પણ ઊડતાં જોયું. શ્યામશિર મુનિયા, ટપૂસિયા પાણી ઊડતાં હતાં. થોડા કલાકો બાદ સામેની દિશા તરફથી પણ મુનિયાની હરફર જોઈ. કમ્ર

## નિર્વિક્ષણ નોંધ

સુધીનાં પાણીમાં ચાલી તે જગ્યા એ ગયો. ત્યાં ચિયામાં પાણીથી ૨ કૂટ ઊંચો, સૂકા, જાડા ઘાસનો અખૂરો બનાવેલો માળો જોયો. વિચાર્યું કે, આ માળો ટપૂસિયા કે શ્યામશિર મુનિયાનો હોવો જોઈએ. તા. ૩-૮-૦૧ના રોજ ફરી માળો તપાસતાં, તેમાં પાંચ સફેદ, લંબગોળ, નાનકડાં હંડાં જોયા, પરંતુ શ્યામશિર મુનિયા કે ટપૂસિયા જોયા નહીં. માળો જાડા ઘાસનો અને અંદર મુલાયમ, પાતળા ઘાસના આવરણથી બનાવેલ હતો. તા. ૧૮-૮-૦૧ના રોજ સાંજે દૂરથી ૩ શ્યામશિર મુનિયાને માળા તરફ ઊડતાં જતાં જોયા. તા. ૨૨-૮-૦૧ના રોજ ચકાસતાં માળો ખાલી હતો અને નીચે તરફ એક કાણું હતું. આ જોઈ નિરાશ થયો, પણ આશર્ય સાથે, તેની નજીક પરંતુ થોડો નીચે, એક અન્ય તેવો જ માળો નજરે ચઢ્યો. તેમાં પ લંબગોળ, સફેદ હંડાં હતાં અને આસપાસ શ્યામશિર મુનિયા ઊડતાં જોયા. બે કલાક બાદ, તે માળામાંથી શ્યામશિર મુનિયા ને બહાર નીકળતાં જોઈ માળો તેનો જ છે, તે ચોક્કસ થયું. મારા ધ્યાનમાં રાજકોટમાં પ્રથમ વાર અને કદાચ સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર શ્યામશિર મુનિયાનું પ્રજનન નોંધાયું હતે. ('બર્ડ્ઝ ઓફ સૌરાષ્ટ્ર' માં શ્યામશિર મુનિયાનો સમાવેશ નથી, તેમજ શ્રી લંબુકુમાર સાહેબ અને શ્રી લાલસિંહભાઈએ તેમણે તૈયાર કરેલ ગુજરાતનાં પદ્ધીઓની સ્થૂચિમાં સૌરાષ્ટ્રમાં તેને વિરલ ગણાવ્યું છે. જો કે, શ્રી લાલસિંહ રાઓલના 'પાણીના સંગાથી'માં "આ પદ્ધી સૌરાષ્ટ્રમાં પણ પહોંચ્યું છે", તેમ જણાવ્યું છે.)

તા. ૬-૮-૦૧ના રોજ માળામાં પ નાનાં બચ્ચાં હતાં, પરંતુ માળાની સ્થિતિને કારણે બચ્ચાંને ખવડાવતાં જોઈ શક્યો નહીં. તા. ૧૪-૮-૦૧ના રોજ ખાસ્સાં મોટાં થયેલ બચ્ચાં હતાં. તા. ૨૦-૮-૦૧ના રોજ માળો ખાલી હતો. તેનું પણ સફળ પ્રજનન નિદાની ખુશ થયો.

એટલું તારણ નીકળી શકે કે, ટપૂસિયા પહેલેથી તેના માળામાંથી તણાખલાં ભેચી જતાં હતે અને તેણે જ માળામાં કાણું પાડેલ હતે. બીજું, શ્યામશિર મુનિયાએ તેનો પ્રજનનનો વિસ્તાર દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ વધાર્યો છે.

અશોક મશરૂ

૧૫, ભક્તિનગર સોસાયટી, ચકડો-૩૬૦૦૦૨

\*\*\*



**કચ્છમાં પદ્ધીનિરીક્ષણ**

'વિહંગ'ના ગ્રીઝ અને વર્ષા- ૨૦૦૧ના અંકો મણ્યા. ગ્રીઝ અંકમાં, ભૂંકપ બાદ, કચ્છના પદ્ધીનિરીક્ષકોના હેમભેમ

હોવાના સમાચાર પ્રસિદ્ધ થયેલા જોઈ 'વિહંગ' પોતીનું હોવાની લાગડી થઈ. કચ્છની ધરા પર ભૂંકપ દ્વારા તિરાઝે પાડ્યા બાદ ઈશ્વરને પોતાના કૃત્યથી પસ્તાવો થયો હોય તેમ સમગ્ર કચ્છને અત્યારે તો લીલી ચાદરથી ઢાંકી દીધું છે! થોડા સમયની ખામોશી અને અસ્તાવ્યસ્તતા બાદ ફરી પક્ષીનિરીક્ષણ શરૂ કર્યું છે, જેની નોંધ આ સાથે મોકલાવું છું.

તા. ૧૨-૮-૨૦૦૧ના રોજ હું અને અશીન પોમલ કુટુંબ સાથે નિંગાળ (તા. અંજાર) તળાવની મુલાકાતે ગયા હતા. વિશાળ તળાવમાં સાંદું એવું પાણી આવ્યું છે.

\* પીળીચાંચ ઢોક (Painted Stork)-ની વસાહત ફરી કાર્યરત થઈ છે. આશરે સવાલસો જેટલા પીળીચાંચ ઢોક જોવા મળ્યા.

\* નર્સરીમાં કેડસમાણાં ઘાસની વચ્ચે ફરતાં કૂટી (Indian Wren Warbler)ના ચાર માળા જોવા મળ્યા. એક માળામાં કૂટી અવાસનવાર ખોરાક લઈ જતી જોવા મળતા તેમાં બચ્ચાં હોવાની ખાતરી થઈ. તેમાં એક નવાઈ જોવા મળી. આ માળામાં કુલ ત્રણ કૂટી, ખોરાક લઈ જતી જોવા મળતાં પ્રશ્ન થાય છે કે, કૂટી સામૂહિક રીતે બચ્ચાં - ઉછેર કરતી હશે રો?

પ્રતાપ સેવક

૩૫, શ્રીકૃષ્ણ સોસાયટી, અંજાર, કચ્છ

\*\*\*



**શિકારી પંખીઓ સાથે સાંજ**

આજનો દિવસ મારા માટે ખૂબ સારો હતો. કારણ કે, મારી સાથે સ્ટીફનપર (RSPB), શ્રી અસદ રહેમાની (BNHS) અને શ્રી મહેશ (BNHS) હતા; જેઓને આંશાંદપુર ચોટીલા વિસ્તારનાં ઘાસનાં વીડ જોવા હતો. તેની પાછળાનો મુખ્ય હેતુ, ખડમોર (Lesser Florican) અને ધોરડ (Great Indian Bustard) માટે આ વિસ્તારની અનુકૂલતા તપાસવાનો હતો. જસદશથી ચાર વાગ્યે (સાંજે) રવાના થઈ દરબાર સાહેબની રહિત, નાની તથા મોટી વીરીઓ જોઈ, આંશાંદપુર તરફ આગળ વધ્યા. આલાશસાગર ડેમના ઉપરવાસ ના વિસ્તારમાં વીજળીના થંભલા ઉપર એક શિકારી પદી બેઠેલું જણાયું. દૂરથીની મદદથી તેને ટીસા (White-eyed Buzzard) તરીકે ઓળખ્યું. અપુષ્ટ હતું, તેની પાછળાના વિસ્તારમાં એક પાનપણાઈ (Marsh Harrier) દેખાઈ. વીડમાં પહોંચતા સુધી સાંજ પડી ગઈ. દિવસ આથમવાને થોડી વાર હતી, તેથી આગળ ન વધીને તે વિસ્તારમાં જ રોકવાનું

## નિર્જાલા નોંધ

નકી કર્યું પાનપણાઈઓ ધીમે અને ઘાસની ઘડી નજીક ઉડતી જોઈ. અમારી ગાડીથી થોડે આગળ દેશી બાવળના જાડ ઉપર એક રીસો (અપુભ) દેખાયો, ઘડો જ નજીક. તાં જ એક પાનપણાઈએ ઉડતો ઉડતો તેની ઉપર જપટ મારી ત્યાંથી ટીસાને ભગાડ્યો. સૂરજ આથમવાની તૈયારી હતી. તેવામાં કબૂતરના કદનું એક શિકારી પક્ષી જરપથી અમારી આગળથી પસાર થયું. શ્રી રહેમાનીને તુરભી (Redheaded Merlins) જેવું લાગ્યું. થોડી વારમાં ફરી અમારી આગળથી પસાર થયું ત્યારે, તેના માચા અને ડેકના લાલ રંગ અને રાખોડી શરીરથી બહુ સરસ રીતે ઓળખ્યું. તે તુરભી જ હતું. ઢણી સંપૂર્ણ શિકાર કરવાની આદતથી આમતેમ ઉડતું હતું. સુર્યસત્તા જોતાં જોતાં અમને વીસ-પચીસથી વધારે પણાઈએ ઉડતી દેખાઈ. આ પણાઈઓમાં એક ઉજળી પણાઈ (Pale Harrier) જેવું લાગ્યું, પણ અંધારું થવા આંધારું હતું તેથી ચોકકસ કહેવું મુશ્કેલ હતું, આમ બપોરથી સાંજના સમયમાં શિકારી પંખીઓની વિવિધ પ્રકારની ગતિવિધિ જોવા મળી.



### જરિયા મહાદેવ (ચોटીલા)માં પક્ષીનિરીક્ષણ

તા. ૨૧-૮-૨૦૦૧થી તા. ૧૨-૮-૨૦૦૧ સુધી W.W.F., ચાંકેટ દ્વારા જરિયા મહાદેવની જગ્યામાં શિબિરનું આયોજન થયું હતું, તેથી આ નવી જગ્યાએ પક્ષીનિરીક્ષણ કરવાનો સારો મોકો મળ્યો. આ વિસ્તારમાં આ વર્ષે ૩૫ થી ૩૮ હિંદુ વરસાદ પડ્યો છે.

આ વિસ્તારમાં જોપેલાં થોડાં પક્ષીની યાદી નીચે મુજબ છે.

સાપમાર (Short-toed Eagle), સાંસાગર (Bonelli's Eagle), મોટો ધુવડ (Great Horned Owl), વર્ષા લાવરી (Rain Quail), લરજ (Kestrel), મોર ગંદમ (Crested Bunting), થોરિયો ગંદમ (Greynecked Bunting), મોટો કાબરો પિદો (Pied Chat), થરથરો (Black Redstart), નાનો શેતકર (Lesser Whitethroat), શ્વામશિર કશ્યો (Blackheaded Cuckoo - Shrike), વગેરે.

દિંગોળગઢમાં આ વર્ષે વરસાદ સારો પણ ખૂબ ધીમો પડતાં તળાવો ખાલી પડ્યાં છે. આ વર્ષે ભીમુકૃદી વિસ્તારમાં દૂધરાજ (Paradise Flycatcher) ઘડી વખત જોવા મળ્યો. એક નર અને બે માદા જોવા મળી. નવરંગ (Indian Pitta) નો અવાજ સાંભળ્યો. ગયા વર્ષ બે વખત કાબરો રાજાલાલ (Whitebellied Minivet) જોપો હતો, પણ આ વર્ષ તેના અવલોકનના સમાચાર નથી. છેલ્લાં ત્રણ વર્ષથી સાપમાર (Short-toed Eagle)-ની જોરી દેખાય છે. મધિયોબાજ (Honey Buzzard) અને ટીસો (White-eyed Buzzard) આ વર્ષે દેખાયા.

ધનશ્યામ જેલાલિયા / ભાવેશ નિવેદી  
/૪૨, માલવિયાનગર, ગોંડલ રોડ, રાજકોટ-૩૬૪૦૦૪



## ટબ્યુકડી નોંધ



તા. ૬-૮-૦૧ના રોજ લીમડી પાસેના અંકેવાળિયાની સીમમાં સર્કેદ કાગડો જોયો.

સમીત શાહ, સુરેન્દ્રનગર

તા. ૨૭-૮-૦૧ના રોજ મેં, મધ્ય મિસ્ટી સાથે પોળોના શિબિર સ્થળ(જિ. સાબરકંડા, તા. વિજયનગર)ના પાછળના ભાગમાં જાંબુના જાડ પર બપોરે ૨-૪૫ વાગ્યે, રાખોડી ચિલોત્રાની (Grey Hornbill) જોડી જોઈ. તા. ૨૮-૮-૦૧ના રોજ બપોરે ૧૨-૪૦ વાગ્યે પણ મેં એક રાખોડી ચિલોત્રા જોડો.

વીરલ પ્રાજ્ઞપત્ર, સુરત

૧૯૯૫-૯૬માં મેં સતત આઈ મહિના એક આંશિક વિવર્જી કાગડો જોડો હતો. તે એકલવાયો રહેતો અને અન્ય

કાગડા તેને સાથે રાખવા તૈયાર ન હોય, તેમ લાગતું. એ જ રીતે મેં વિર્ષા ચકલી પણ જોઈ છે. કચુણમાં તેને 'જખ બચ્યાં' કહે છે. 'જખ' એટલે યક્ષ. 'વિહંગ' અંક ૧૩માં ડો. પીપુષ પટેલ, વલસાડની 'આલબીનો વન લેલા'ની નોંધ વાંચી હું ઉપરોક્ત લખવા પ્રેરાયો છું.

કવિ તેજ, નલિયા

મેં આ વર્ષે પહેલી પર્વીપણાઈ (Montagu's Harrier) તા. ૧૬-૧૦-૦૧ના રોજ દેવળિયા (ગીર અભયારણ્ય) ખાતે જોઈ. તે નર હતો.

ગૌરંગ જેષી, ગોંડલ

## ટચ્યુક્ટક્રી નોંધ

જોડી This year I saw my first Kashmir Roller flying, on Sunday 23rd Sept.' 01.

*Lavkumar Khachar, Gandhinagar*

જોડી ૧૫-૮-૦૧ના રોજ મૂળી તાલુકા (જિ. સુરેન્નગર) માં એક વીડીમાં ખડમોર (Lesser Florican) જોયો.

ચેતન ત્રિવેદી/ સમીત શાહ, સુરેન્નગર

જોડી તા. ૨૬-૬-૦૧ના રોજ મારા દોસ્ત અકીલને તેના ધરના આંગણમાં એક મૃત પકી મળ્યું. અમે તે ઓળખી શક્યાં નહીં. પ્રકૃતિ મિત્રમંડળના અમારા પ્રમુખ, શ્રી અજ્યભાઈ દેસાઈને તે બતાવતા તેમણે તેને 'નવરંગ' (Indian Pitta) તરીકે ઓળખ્યું. તેમણે આ પકી

પહેલાં રતનમહલમાં એક વાર જોયું હતું. તે સિવાય, દાહોદની આસપાસ તે જોવા મળતું નથી. દાહોદના ભરચક વિસ્તારમાં મૃત અવસ્થામાં તેનું મળી આવવું, આશર્યજનક કહેવાય! તેના પર કોઈ ઘાન હતો.

શાકીર કરીવાલા, દાહોદ

જોડી આજ રોજ દાંડી રોડ પર પકીનિરીક્ષણ કરતાં સુગરીના અસંખ્ય માણા જોયા. અહીં સુગરીની માદાને પોતાના માણા પર લક્કડખોદની જેમ, ચિયામાં ઉપરથી નીચે સરકીને ધીમે ધીમે જતા જોઈ. વચ્ચે વચ્ચે તે બચ્ચાને ખવડાવી ખોરાકની શોખમાં ઉડી જતી. (તારીખ? - સં.)

દેવન ખાટીવાલા, સુરત

## સારસ વોટ્

\* સારસની વસ્તીગણતરી માટે ઉપયોગી પદ્ધતિ

પકીસંરક્ષણ અંગેના કોઈ પણ અભ્યાસને શરૂ કરતા પહેલાં પકીની સંખ્યા જાણવી, પાયાની જરૂરિયાત બની રહે છે. પકીની કોઈ પણ જીતિ હોય, માત્ર તેનો વ્યાપ અથવા સ્થિતિ (status) અંગે થોડાં વિશેષજ્ઞો વાપરીને તેની વસ્તી માટેનું સાચું ચિત્ર ઊભું ન કરી શકાય.

પ્રસ્તુત અભ્યાસમાં, ખેડા જિલ્લાના માતર તાલુકામાં બે સંખ્યા ઉનાળામાં સારસની ગણતરી હાથ ધરાઈ. ગણતરી માટે બે પદ્ધતિનો ઉપયોગ થયો. (૧) બપોરની ગણતરી અને (૨) રાની ગણતરી, '૭૭ એપ્રિલ, મે, જૂન દરમિયાન તથા '૭૮, ૨૪-૨૫ મે દરમિયાન બપોરે ૧૨થી ૪૮ના સમય ગાળામાં આ ક્ષેત્રનાં કેટલાંક જળાશયો તથા તેમની આસપાસના વિસ્તારોમાં આ ગણતરી કરી.

૧૯૮૮, ૧૭-૨૪ મે દરમિયાન અમુક જળાશયો પર મોડી સંઝે સારસની ગણતરી કરી. અંધારું થાય ત્યાં સુધી પ્રત્યેક જળાશય પર ઉપસ્થિત તથા અન્ય આવી રહેલાં સારસની સંખ્યા ગણી. આ દિવસોમાં સૂર્યસ્તનો સમય લગભગ ૭-૧૫ વાગ્યાનો હતો. ઉનાળા દરમિયાન માત્ર જળાશયો તથા અન્ય આસપાસનાં ડાંગરનાં ખેતરોમાં જ પાણી હોય છે. ખોરાક માટે સારસ, સવારે તથા સંઝે અમુક કલાકો દૂર દૂર સુધી મુસાફરી



કરતાં હોય છે, પણ બપોરે તથા રાતે તેઓ ગરમી ખાળવા જળાશયો નજીક આવી જતાં હોય છે. આ જગ્યાઓ લગભગ નિશ્ચિત જ હોય છે. બપોરના તથા રાત્રિના આ સમય દરમિયાન પકીએ ખાસ કોઈ સ્થાનાંતર (movement) કરેતાં નથી, તેથી આ સમય દરમિયાન કરેલી ગણતરીમાં પુનરાવર્તનની સંભાવના નહીંવિદ્ય હોય છે.

દિવસની ગણતરી વધુ સરળ છે, કારણ કે, તેમાં ઓછી વિઝિલોની જરૂર પડે છે. બપોરે ન્રષા-ચાર કલાક દરમિયાન સારસ એક જ જગ્યાએ રહે છે, તે ગાળામાં ગણતરીકાર પોતાના વાહનમાં થોડાં ધ્યાં જળાશયો ફરી શકે છે. રાત્રિ ગણતરીમાં આ રીતે ફરવાનું શક્ય નથી તેથી વધુ માણસોની જરૂર પડે છે.

ડાંગરની ખેતીની સારસના વ્યાપ ઉપર અસર રહે છે. સારસ, ડાંગરની ક્યારીઓનો રાતવાસા તરીકે પણ ઉપયોગ કરી શકે છે, એટલે ડાંગરનું વાવેતર બહોળા પ્રમાણમાં હોય તો ગણતરી ક્યારીઓ મોટા વિસ્તારમાં કેલાયેલી હોય તો ગણતરી મુશ્કેલ બને છે. નબળા ચોમાસા પછી જરૂરે પાકનો વિસ્તાર સીમિત હોય છે ત્યારે, સારસ ચોક્કસ જળાશયો પાસે કેન્દ્રિત થવાથી ગણતરી સહેલી બને છે.

અમારા અભ્યાસમાં રાત્રિ ગણતરીમાં સારસની સંખ્યા

## શાકશ વોય

વધુ થઈ હતી. પરિચિત વિસ્તારોમાં રાત્રિ ગણતરી સારાં પરિણામો આપી શકે, માત્ર, પ્રત્યેક જગતાશય દીઠ એક બ્યક્ટિની જરૂર પડતાં વધુ માણસોને સંકણાવા પડે. (BNHS' AUG, 2001, PAGE 23ના આધારે સંક્ષિપ્ત અનુવાદિત સંકલન- સંપાદક)

અભિનાત મુજબ, સી.કે.બોડ, એસ.ડી.પટેલ, ડૉ.ડી.એમ.પાટેશર્વ  
ગુજ. એન્સ્ર. મુનિ., આંદ્રા 322910

\*\*\*

### \* આવલોકન નોંધ

⇒ વેળાવદર રાજ્યીય ઉદ્ઘાનમાં તા. 3-૬-૦૧ના રોજ એક જોડી સારસની જોવા મળી.

હુંઘંતસિંહ જાલા

ખોટનંબર ૨૩૨૩-એફ, પ્રથમાનેટસ, સુભાષનગર, ભાવનગર.  
⇒ તા. ૧૨-૮-૦૧ના રોજ નિગાળ તપાવ (તા.અંજાર)માં વચ્ચે આવેલા બેટ ઉપર એક સારસ દંપતી જોયું. સારસ અવારનવાર બેસીને ઈડાં સેવંતું હોય તેવી શંકા ગઈ. ત્યાંના આર. એફ. ઓ. શ્રી નિવેદી તથા અન્ય કર્મચારીઓ સારસ અંગે સંચિત જણાયા.

### પ્રતાપ સેવક

વાચાગાંધી સોસાયટી, સવારોર નકા, અંજાર ૩૭૦૧૦

⇒ તા. ૨૮-૮-૦૧ના રોજ મુણી રોડ ઉપર 'મેલીમા'થી આગળના રસ્તા પાસે તલાવડી છે, તેમાં

સારસનો માળો જોયો. માત્રી સાથે મિત્ર ચેતન નિવેદી હતા.

સમીત શાહ

૫, કુંસોસાયટી, પલ્સીસ મીલ પાસે, સુરેન્નગર-૩૬૩૦૦૧

⇒ તા. ૨-૧૧-૨૦૦૧, અંકેવાળિયાથી લીમરી જતા રસ્તામાં, ૨ પક્ષી.

⇒ તા. ૧-૧૧-૨૦૦૧, સમલા ગામની સીમમાં, ૨ પુષ્ટ, એક મોટું થયેલું બચ્યું.

ચીકુ વોરા, યોગેન શાહ

વાલ્સ્પુરા, દ્વિરેજ રોડ, /'આનંદ', અજારાયા સો. પાસે, ઊત્તાન રોડ, સુરેન્નગર ૩૬૩૦૦૧

### સારસની સંખ્યા

૫-૧-૦૨	મેશ્યો	૨
૧૨-૧-૦૨	સિપુ	૨
૧૨-૧-૦૨	દાંતીવાડા	૪
૧૩-૧-૦૨	મોકેશ્વર	૪
૧૩-૧-૦૨	દાંતીવાડા	૫

દદ્ય વોરા

૧૬૮, સ્વિટલોમ એપાર્ટ., સેક્ટર-૨૮, ગાંધીનગર-૩૮૨૦૨૮

⇒ ૨૬-૧-૦૨      પરિનેજ      ૫૫

લાલસિંહ રાઓલ / પી.એસ. ટક્કર

/૨૪, નુંનંનવન સોસાયટી, 'ઇસરો' પાછળ, અમદાવાદ-૩૮૦૦૧૫

❖

## શાલાક રવીલાક

૨૦૦૦-૦૦ શ્યામા શોધન, અમદાવાદ	૨૫૦-૦૦ અજય ટેસાઈ, ભાડ્યાંવડ	૧૦૦-૦૦ જ્યરાજભાઈ બબી, નવસારી
૧૦૦૦-૦૦ કર્મચારીના ભક્ત, સુરત	૨૫૦-૦૦ શરીકાન્ત બાબુભાઈ, મુંબઈ	૧૦૦-૦૦ મનીષ અલાવાડિયા, જીમનગર
૧૦૦૦-૦૦ જ્યોતિલ કક્કર, અમદાવાદ	૨૦૧-૦૦ પ્રદીપ નાયક, અમદાવાદ	૧૦૦-૦૦ કનુભાઈ જાની, અમદાવાદ
૪૧૧-૦૦ જ્યંત સેવક, અમદાવાદ	૨૦૧-૦૦ પ્રણાવ પાટક, અમદાવાદ	૧૦૦-૦૦ રસિલાબેન કરિયા, અમદાવાદ
૪૦૧-૦૦ મુકેશ આચાર્ય, અમદાવાદ	૨૦૧-૦૦ દેશાં પગી, અમદાવાદ	૧૦૦-૦૦ મુકેશભાઈ થોરિયા, રાજકોટ
૪૦૦-૦૦ કુલાલ પટેલ, નવસારી	૨૦૦-૦૦ શાંતિભાઈ વડ, ભુજ	૧૦૦-૦૦ દિલીપભાઈ જીથી, રાજકોટ
૪૦૦-૦૦ આર. એલ. શાહ, જામનગર	૨૦૦-૦૦ પરોશ ભંડ, આંશંદ	૧૦૦-૦૦ નિરિચાજસિંહ રાઓલ, રાજકોટ
૪૦૦-૦૦ પ્રણાવ શાહ, અમદાવાદ	૧૫૦-૦૦ જ્યેમ્પ્રકાશ પંજ્યા, અમદાવાદ	૧૦૦-૦૦ ખરોશ તમા, રાજકોટ
૪૦૦-૦૦ જે.પી. જોથી, મુંબઈ	૧૫૦-૦૦ રોહિત વાસ, વડોદરા	૧૦૦-૦૦ રમેશચન્દ્ર પટેલ, ભરૂય
૪૦૦-૦૦ નંદિતા મુનિ, ભાવનગર	૧૫૦-૦૦ અશોકભાઈ મશરૂ, રાજકોટ	૧૦૦-૦૦ ડી. એમ. હુમ્બર, અમદાવાદ
૪૦૦-૦૦ કાર્તિક ઉપાધ્યાય, વડોદરા	૧૫૦-૦૦ જ્યંદેવ ધાયલ, ભાડ્યાંવડ	૧૦૦-૦૦ અણત ભક્ત, ધારી
૪૦૦-૦૦ ગૌરાગ જોથી, ગોડલ	૧૫૦-૦૦ અચ્યુત પોમલ, ભુજ	૫૦-૦૦ વિરાગ પટેલ, નવસારી
૨૫૦-૦૦ રાજુદીમિ, કોણા	૧૨૦-૦૦ નરહરેભાઈ ભક્ત, સાંકંદ	❖ ❖
૨૫૦-૦૦ રિમેન જોથી, આંદ્રા	૧૦૦-૦૦ મોહંમેદ હુસેન ગેણા, અમદાવાદ	

## ગીધ પર જાપતો



**બાકરથળીમાં**  
ગીધના મૃત્યુનો સીલસિલો  
ચાલુ જ છે.  
‘વિહંગ’ના ગયા અંકમાં  
(શરદ-૨૦૦૧) બાકરથળી  
(જિ. સુરેન્દ્રનગર)ની અમારી  
૧૯-૭-૦૧ ના રોજ લીધેલી  
મુલાકાત અંગે જણાવ્યું હતું.  
અમે ફરી તા. ૨૦-૧૦-  
૨૦૦૧ના રોજ ‘ગીર  
ફાઉન્ડેશન’ના વૈજ્ઞાનિક શ્રી  
કેતન ટાટુ સાથે ત્યાં ગયા હતા.  
ત્યારે પણ ગામલોકોએ જણાવ્યું  
કે, છેલ્લા નજી માસમાં અનેક  
ગીધ મરી ગયા છે. એક  
વ્યક્તિના અંદાજ પ્રમાણે ૨૫  
થી ૩૦ ગીધ છેલ્લાં બે -નજી  
મહિનામાં (ઓગષ, સપ્ટે. અને  
ઓક્ટો. ૨૦૦૧) મરી ગયા છે.

તા. ૪-૧૧-૨૦૦૧ના રોજ અમારા મિત્ર ફારુક  
ચૌહાણને ગીધનો એક મૃત્યુદેહ મખ્યો હતો, પણ મૃત્યુદેહ  
ખરાબ થયેલો હોવાથી અમે તે ‘પુના ઈંસ્ટીટ્યુટ’માં ન  
મોકલી શક્યા.

ચીકુ વોરા, યોગેન્ઝ શાહ

તાંત્રીપુરા, દૂરરોજ/ ‘આનંદ’, અજાતનાથ સો. પાસે,  
જાતાન રોડ, સુરેન્દ્રનગર ૩૬૩૦૦૧

\*\*\*

### અવલોકન નોંધ

> સુરતથી ૩૦ કિ.મી. દૂર ગાયપગલાં નામનું  
ધાર્મિક તીર્થ છે. તેની બાજુમાં જ પાંજરાપોળ આવેલી છે.  
તેની નજીકના વડના જાડ પર ગીધ દરરોજ જોવા મળે છે.  
(તા. ૮-૮-૨૦૦૧) (કેટલી સંખ્યામાં ?- સ.).

મુકેશ ભટ્ટ, સુરત

> તા. ૨૬-૮-૦૧ના રોજ મુળી રોડ  
ઉપર કાગોડી (કુતલપુર)પાસે ગામની બહાર  
મરી ગયેલાં ઢોર નાખેલાં હતાં. ત્યાં ૭૦ થી  
૭૫ ગીધ એક સાથે જોયાં. એક નહીં ઉંડી શકતા  
ગીધને ફૂતરાં દ્વારા ચૂંથી નાંખવામાં આવેલું હતું.

સમીત શાહ, સુરેન્દ્રનગર

> તા. ૧૫-૮-૦૧ના રોજ જાંબુધોડા અભયારણ્ય  
ગયા. કડા તેમ વિસ્તારમાં પક્ષીઓ અલ્ય સંખ્યામાં હતાં.  
વરસાદી વાતાવરણ હતું. જાંબુધોડાથી રાયપુર જવા નીકળ્યા.  
‘મોટા કંટવા’ ગામના પાટિયા પાસે, રસ્તાની બાજુમાં આવેલા  
લીમડા પર નજર કરતાં એક મોટા કદનું પક્ષી જોયું. તે બીજું  
કોઈ નહીં પણ સફેદપીઠ ગીધ હતું.

તસવીર દેવા જતાં તે ઊરીને હુંગરાના ઢોળાવ પર જઈને  
બેંક. ત્યાં નજર કરતાં જોયું કે, ગીધનું જું હતું. ગણતરી  
કરતાં તુ ગીધ થયાં. પાંચ વર્ષ પછી ગીધ જોયાં. આજુબાજુ  
કોઈ મૂત પણ ન હતું. પાંચ વર્ષ પહેલાં ગોરવા ગામના વડ  
ઉપર ગીધ જોયાં હતાં.

અનિલ ઓણિલ/ ભાવિક પટેલ, વરોદા

> અમારા સાંનંગપુરના પ્રવાસ દરમિયાન લોથલ  
પાસે આવેલા ગુંઠી ગામની સીમામાં આવેલાં ખેતરોમાં મેં  
તા. ૭-૧૦-૨૦૦૧ના રોજ બપોરે ૧૨-૩૦ વાગ્યે, ૩૦  
જેટલાં સફેદપીઠ ગીધનું ટોળું જોયું.

વિરેન્સિન ગાવા, વરોદા

> ૨૦-૮-૦૧, ૧૨ ગીધ ઉડતાં, માંડવી (જિ. સુરત)  
જથૂત ભોજવાલા, સુરત

> બાલારામ (જિ. બ.કા.) નર્સરીથી ૭ કિ.મી.,  
મેરવાડ જૈન પાંજરાપોળ પાસે, આશરે ૬૦ + ગીધ તથા  
૭૦+ ખેરા (Scavenger Vulture) છેલ્લાં બે વર્ષથી નિયમિત  
જોવા મળે છે.

જથૂત મચ્છર, ગાંધીનગર

> ૨૫-૧૦-૨૦૦૧, વઢવાણ પુલ પાસે, ૬૮  
ગીધ (લેખક ?)

## ગીધ પર જાપતો

> ગોધરા મુકામે અવારનવાર આકાશમાં ચકરાવા મરતાં ૧૫ થી ૨૫ની સંખ્યામાં સફેદપીઠ ગીધ જોવા મળે છે. તા. ૨૨-૩-૨૦૦૧ના રોજ મારી ફરજની રૂમે અછત રાહત કામ ચાલુ કરવાના આશયથી સવારે ૮-૦૦ કલાકે ગોધરા તાલુકાના સારંગપુર ગામનાં ભાડીના ઘોડાકળિયામાં જતો હતો ત્યારે, આકાશમાં નજર માંડતા ખૂબ મોટી સંખ્યામાં ગીધ જોવા મળેલ. આ સંખ્યા ૧૦૦+ જણાયેલ હતી. સ્ટાફને પૂછતા નજીકના પોપટપુરા ગામે હાડકાનું કારખાનું આવેલ હોવાથી કદાચ આટલી મોટી સંખ્યામાં ગીધ આકાશમાં ચકરાવા મારતાં દરે તેમ જગતાયેલ. ફરજના કારણોસર તાકીદે કામના સ્થળે પહોંચ્યું પડે તેમ હોવાથી ગીધ ઉત્તરવાના સ્થળે પહોંચી શકાયેલ નહીં.

સુનીલ કે. પુવાર, રેજફોરેસ્ટ ઓફિસર, ગોધરા

> ૧૨-૧-૨૦૦૨ના રોજ દાંતીવાડા તેમ પાસે ૪ ગીધ આકાશમાં ઉડતાં જોયાં હડમતિયા તેમથી દાંતીવાડા તરફ જતાં ૭ ગીધ જોયાં. તા. ૧૩-૧-૨૦૦૨ના રોજ સિપુ તેમ પાસે ૧૧ ગીધ જોયા.

ઉદ્ય વોરા, ગાંધીનગર

> તા. ૬-૭-૦૧ના રોજ લુજ-ભચાઉથી પાછા વળતાં (વાયાપ્રાંગધા), માલવકથી ૧૬ ક્રિ.મી. પહેલાં, સાંજે ૬.૪૫ વાગ્યે, ટેલિફોનના થાંબલા ઉપર ૧ અને વૃક્ષ ઉપર ૧ ગીધ જોયાં.

૭.૧૦ વાગ્યે સાંજે, વિરમગામ પાસે, ૩ ગીધ ઉડતાં જોયાં. વિરમગામથી ૧૨.ક્રિ.મી. દૂર, ૭.૧૬ વાગ્યે વક્કિગામ વડ ઉપર ૭.ગીધ જોયાં.

૧૬-૮-૦૧ના રોજ પાટશ બસ - સ્ટેન્ડની પાસે સવારે ૧૦.૧૫ વાગ્યે ૧૦ ગીધ ઉડતાં જોયાં.

કાર્તિક શાસ્ત્રી, અમદાવાદ

\*\*\*

**અમદાવાદમાં ગીધની અવલોકન નોંધ**

(વધુ વીજત પાન ૧૬ - ૨૦ પર કોષ્ટકાં)

> જુલાઈ તથા ઓગસ્ટ '૦૧ના દરમિયાન ૧૩૨ કૂટ રીંગરોડ, અધ્યજન મંડળ પાસે મોટા મેદાનમાં, પાણી પાસે ૧૨૫ થી ૧૫૦ જેટલાં ગીધ જમીન ઉપર બેઠેલાં જોવા મળતાં. તેમનો

સમય સવારના ૧૧ થી ૧૨ વચ્ચેનો રહેતો. તેમાં ર ગિરનારી ગીધ (Longbilled Vulture)ની હાજરી પણ જોવા મળતી. ઓગસ્ટના અંતમાં બાવન જેટલાં ૪ ગીધ આવતાં. ત્યાર બાદ, પાણી સાવ ખલાસ થઈ ગયું હતું. હાલ તાં ગીધ આવતો નથી.

> શાહીબાગ ખાતે આ સાલ પક્ષીઓની હાજરી દેખાતી ન હતી, પરંતુ ડિસેમ્બરની શરૂઆતમાં ૪ થી ૫ પક્ષી દેખાવા માઝ્યાં.

> ૧૬-૧૧-૦૨ના રોજ માદલપુર, પશુનાદવાખાના ખાતે ૪ ગીધ, દોરીથી ગંભીર રીતે ઘવાઈને આવ્યાં છે.

> ૨૧-૮-૦૧ના રોજ અમદાવાદથી થોળ જતાં, ડાખલા પાંજરાપોણ પાસે ૧૭ ગીધ ઉડતાં જોયાં તથા અલગ અલગ જૂથમાં, બેઠેલાં ૪૪ ગીધ જોયાં. આમાં ૧ ગિરનારી ગીધ હતું. તા. ૧૬-૮-૨૦૦૧ના રોજ ડાખલા ખાતે બેઠેલાં ઉરગીધ અને ૧૫ ઉડતાં ગીધ જોયાં.

> સહજાનાં કોલેજ પાસે, ૨૨-૮-૦૦ની રાતે લીમડા ઉપર, જૂના માણા પાસે બે ગીધ જોયા હતાં. થોડા દિવસ ગીધે ઠૂઠું સેવ્યાં બાદ, ગીધ માળો છોડી ગયેલ અને પછી તે માળાનો ઉપયોગ એક સમરીની જોડે કરેલ અને તેણે પણ ત્યાર બાદ છોડી દીધો હતો. સાટેમ્બર '૮૮માં આ માળામાં એક ગીધ મરી ગયું હતું. આ સાલ ૧-૧૧-૦૧ના રોજ લીમડા ઉપર ગીધને ફરી બેસતા જોયું. બીજું ગીધ બીજા લીમડા ઉપર બેઠું હોય છે. હાલ પણ ગીધ માળામાં ઠૂઠું સેવે છે. તા. ૧૬-૧-૦૨ના રોજ પંખી માળો છોડી ગયેલ છે.

**કાર્તિક શાસ્ત્રી**

અશોકવાડી, પંચવટી, અમદાવાદ-૩૮૦૦૦૮

**પંખી લોક**

હમણાં જ પંખી આવીને ઉડી ગયું.

હમણાં જ

પંખી તો અવશ્ય આવે જ છે.

પણ હું દર વખતે પંખીને ચૂકી ગયો છું.

ચંદ્રકાના ટોપીવાળા

પક્ષીઓની તસવીરોનું પ્રદર્શન : ડૉ. આર.બી.બલર  
તા. ૨૪ થી ૩૦ એપ્રિલ, ૨૦૦૨ : સાંજે ૪-૦૦ થી ૭-૩૦  
કોન્ટેમ્પરરી આર્ટ ગેગેરી, ગુજ. કોલેજ પાસે, એલિસબ્રિજ, અમ-૬

ગોધ પર જાપતો									
જાપતો	દૂષ	ગોધની સંખ્યા		માળાની સંખ્યા		ભર્યાની સંખ્યા	ઉંડણી સેવન	ગચ્છ દર્શન	નોંધ
		ગ્રાન્યાસનો	માળા પાસે	ટોચ ઉપર	મધ્યમાં				
અસ્પેચાલ	લીમડે	૧ ૧૪+૬	૧	૧	-	-	-	-	જાણ વધતું રાખીયાલ બસ સ્ટેન્ડ, હીરા ટ્રેનીંગ સ્કૂલમાં, લીમડા ઉપર ૧ ગોધને જોયું. અને એક વધત સ્પોર્ટ ટેકનોલોજી ઉપર ક્રિકેટ જોયું. ૧૧-૧-૦૨ના રોજ એક લીમડા ઉપર ૧૪ ગોધ અને બીજી ઉપર ૩ ગોધ જોયાં.
સારંગપુર થીજી	ઘોપળો (૧)	-	૧	-	૧	-	૧	-	સારંગપુર રેલવે પુલની સામે -ઘોપળો ઉપર મધ્યમાં છલ છે.
સાલજાંડ ફ્રેન્ઝ	લીમડે (૨)	-	૧	-	૧	-	૧	X	સાલ્ફે. હલ્લાં માળામાં ગોંધનું મૂલ્ય થયું હશ્ય. છલ ૧૮-૧-૦૨ના રોજ ગોધ માળો છોડ્યે ગયું છે.
ગાંધીઆશ્રમ	લીમડે (૨)	૫ થી ૨૩	૨	૧	-	૧	-	-	ગાંધી આશ્રમની સામે લીમડા ઉપર માળામાં એક જોડે હોય છે. બચ્ચનું પણ છલ છે. ગાંધી આશ્રમ સામે ખાદી મંદિર પાસે લીમડા ઉપર માળો છે. ગોધ બેઠેલું હોયે છે.
શીર્ષનભાઈ થીજાની આંગુંયાં	લીમડે (૧)	૧થી ૪	૨	૧	-	-	૧	-	લીમડા ઉપર બાહુ જ ખૂલ્લો દેખાય તેથે માળો છે. ગોધ, ટીકુ સેવે છે. થોડે દૂર બીજું ગોધ સતત બેઠેલું દેખાય છે.
સાલજાંડ સ્ટેશન	નીલાજિસ્ટ લીમડે	૬ થી ૩૩	-	-	-	-	-	-	૨૪-૧૧-૦૧ના રોજ માળામાં ગોધ, ટીકુ સેવે છે.
	લીમડે	૫ થી ૨૨	૨	૧	-	-	૧	-	૧૮-૦૧-૦૧થી આ માળામાં પણી બેઠેલું જોવા મળે છે.
સાલજાંડની કુંડ કેબિન	લીમડે (૧)	-	૧	-	૧	-	૧	-	બાજુના ઘોપળામાં ૨૫ ગોધનો ગ્રાન્યાસનો છે. છલ પણ ટીકુ સેવાય છે.
સૌ.એન. સ્કૂલ	લીમડે (૧)	-	૧	૧	-	૧	-	-	આ વર્ષે પ્રથમ વધત માળો જોયો. એક પણી માળામાં હોય છે. બીજું તેનો આસપાસ હોય છે. તા. ૧૮-૧-૦૨ના રોજ માળો ખાલી હતો.
ઓનાઓઈ.કે.ન સામે	લીમડે (૧)	૨	૧	-	-	૧	-	✓	તા. ૨૪-૧૦-૦૧ના રોજ લીમડે ક્રાયેલો છે. થડની ઉપર થોડેક ગળીઓ ફૂલેલી છે. ટોચ ઉપર થોડેક ગળીઓ ફૂલેલી છે. ટોચ ઉપર માળો છે અને તેમાં પણીઓ બેસે છે.
અંગ્રેઝ વિજય	લીમડે (૧)	૨૨	-	-	-	-	-	-	આ વર્ષે તા. ૮-૧૦-૦૧ના રોજ ઉરીયા વિજય અંગ્રેઝ રાણીના પૂત્રાની સામે લીમડા ઉપર જોવા. તેમની સાથે ૨ સંક્રાંતેક કેંક પણ હતાં. તા. ૮-૧-૦૨ના રોજ પણ બે ગોધ હતાં.

**ગીધ પર જાપતો**

જગ્યા	વૃક્ષ	ગીધની સંખ્યા		માળાની સંખ્યા		બગ્યાની સંખ્યા	ટીડા સેવન	ગયા વર્ષે સફળતા	નોંધ
		રાતવાસો	માળા પાસે	ટોચ ઉપર	મધ્યમાં				
લો. ગર્ડન ક્રમિકસ્ટર્પો બંગલાં	શિરીષ (૧)	૧	૨	૧	-	-	-	-	તા. ૨૦-૮-૦૧ના રોજ જૂના માળાની જગ્યાએ નવા લીલાં પાનનો નવો માળો હતો.
આડાં:આંદ, એમ ની બધાર	લીમદ્રે (૧)	-	૨	૧	-	-	-	✓	ગયા વર્ષ, પાછળથી માળો ધ્યાનમાં આવ્યો હતો. આખા વર્ષ દરમિયાન પક્ષીઓ બેસલાં. લીમદ્રેના એક છેડે ગીધનો અને બીજા છેડે સમયો- માળો છે. બજે ઈંગ્રેઝ સેવનાં દેખાય છે.
ટેલાક બાગ પૂલના પૂર્વ કિંડે	લીમદ્રે (૧)	-	૨	૧	-	-	-	-	લીમદ્રે ઉપર પ્રથમ વખત માળો જોયો. બાજુના અરદૂસા પર પહેલાં પક્ષીઓ રાતવાસો કર્યાં. કમાળાના ટેલાક વખતની પક્ષીઓ ન હતાં, પરંતુ તા. ૧૫-૧-૨-૦૧ના રોજ માળો ધ્યાનમાં આવ્યો.
ગુજરાત ક્રોલેજ	અરદૂસો (૨)	૧૩૦૧૪	-	-	-	-	-	-	જૂન, જુલાઈમાં પક્ષી ઓછાં હતાં. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં હોડી વધ્યા.
ક્રે.મુન્શીની છેસ્પીટલના ખાંચામાં	લીમદ્રે	-	૧	૧	-	-	૧	✓	લીમદ્રે ટોચ ઉપર એક ગીધ ઈંડું સેવે છે. આ માળાનો ઉપયોગ ફૂલી વાર થયેલ છે.
લોગર્ડન	નીલગિરિ		૧	૧		૧	----		.....
એલ.પી.એન્જિન ક્રોલેજ પાસે	અરદૂસો		૧		૧	૧			બાજુના આડ ઉપર બીજું ગીધ બેસો રહે છે.
ક્રે.મુન્શીના બાજુના ખાંચામાં બંગલામાં	લીમદ્રે (૧)	-	૧	૧	-	-	૧	✓	મુન્શીના ખાંચાની બાજુના બંગલામાં લીમદ્રેની ટોચ ઉપર આવેલા માળામાં ઈંડું સેવાય છે. આ માળાનો ઉપયોગ ફૂલી વખત થયેલ છે.
હાઈર્સ્ટોર્ગના દાદેંસ	શિરીષ (૧)	૧૦	૨	૧	-	-	૧	✓	હાઈર્સ્ટોર્ગના દાદેંસની અંદર, મિનારાની પાછળ જરૂર જૂના માળાનો ઉપયોગ આ જોડે કર્યો છે.
એડ્યુનાસ મીલની બધાર	પીપળો (૧)	-	૨	૧	-	-	૧	✓	એડ્યુનાસ મીલની બાબર હનુમાન મંદિર પાસે પીપળા ઉપર જૂના માળાનો ઉપયોગ ધાલ પણ પક્ષીઓ છે.
સ્વામિનારાથાયુ મંદિરની બાજુના	લીમદ્રે	૬ (૧)	૧	૧	-	-	૧	-	સ્વામિનારાથાયુ મંદિર, શાહીબાગની પાસે લીમદ્રેની ઉપયોગ રાતવાસો માટે થતો. ત્યાર બાદ, એક જોડેિઓ ત્યાં નવો માળો ઝોલ છે.
હાઈર્સ્ટોર્ગના દાદેંસની સામે	લીમદ્રે (૧)	૨૨	-	-	-	-	-	-	પક્ષીઓએ જૂન મહિનાથી રાતવાસો કરવાનું શરૂ કર્યું હતું. ધાલ પણ હોય છે.

## પત્ર-કોટુ

### ૧૦ પક્ષીગણતરીથી વિરોધ કરીએ

સૌ પ્રથમ તો સર્વે મિત્રોને મારા નમસ્કાર ! આપણે સૌ રૂખરુ તો મળી શકતા નથી, પરંતુ ‘વિહંગ’ દારા આપણા વિચારો તથા માહિતીની આપલે કરી શકીએ છીએ. તે બદલ આપણે ‘વિહંગ’ના સંપાદકીયગણના હમેશાં અણી રહીશું.

‘વિહંગ’માં ઘણાં મિત્રોના લેખમાં તેઓની નોંધ ઉપરંત, ખૂબ જ અનુભ્વતી એવા તજશોની નોંધમાં વાંચવા મળે છે કે, “થોડાં વર્ષો-પહેલા અમુક પક્ષીની જાત અહીં જોવા મળતી, પરંતુ આજે બહુ જ જૂજ સંખ્યામાં જે - તે સ્થળે આવે છે.” આવું શા માટે બન્યું ? શું સરકારની નિતિઓ, ઉદ્યોગોનો વિકાસ તથા પ્રદૂષણ જ આ માટે જવાબદાર છે ? ના ! હું સૌ પ્રથમ આપણાને સૌને આવું થવા માટે જવાબદાર ગણતાવીશ. કારણ કે, આપણે બધું જ્ઞાતાં હોવા છતાં બીજી પ્રવૃત્તિઓમાં વધારે વસ્ત રહીએ છીએ. આ એક હકીકત છે.

મિત્રો, આપણે ત્યાં (ગુજરાતમાં) ઘણી જ બહોળી સંખ્યામાં પક્ષીનિરીક્ષકો છે, પરંતુ કદાચ સમયના અભાવે આમાંના ઘણાં મિત્રોને માત્ર પક્ષીઓની યાદી બનાવવામાં તથા પક્ષીનિરીક્ષક કરવામાં વધારે રસ છે. ‘પક્ષી નિરીક્ષકાં’, એ પ્રકૃતિ સંરક્ષણ અંતર્ગત એક પ્રવૃત્તિ કરી શકાય, પરંતુ આ ‘પ્રવૃત્તિ’ કરવા પાછળનો ઉદ્દેશ આપણે ‘નૂલી ગયા હોઈએ એવું લાગે છે. આથી જ આપણે આજે પક્ષીગણતરી જેવી પ્રવૃત્તિઓમાં જ વસ્ત રહીએ છીએ. પક્ષીઓનાં રહેઠાણ (Habitat) સાચવવામાં કે ત્યાં તેઓનું પ્રજનન શક્ય બને તેવા અનુકૂળ સંજોગો ઊભા કરવામાં, વેઢે ગણી શકાય તેટલા લોકો જ કાર્યરત છે. આજે ‘પીરોટન’, ‘ખીજરિયા’, ‘નણસરોવર’ તથા ‘ગીર’ જેવા અનેક વિસ્તારો નાશ પામી રહ્યા છે અથવા તેમની સામે ખતરો છે. ખડમોર (Lesser Florican), ટિલોર (Houbara), ધૂવડ (Owl), ધોરડ (Great Indian Bustard), ગીર (Vulture) તથા ઘણાં શિકારી પક્ષીઓ (raptors)ની જાતો બહુ જ જરૂરી નાશ પામી રહી છે. શું પક્ષીગણતરી કરવાથી કે વિવિધ ‘મિટીઓ’ કરવાથી બધું બચી જશે ? આવું ક્યાં સુધી ચાલશે ? દા.ત. ૧૯૮૮માં રાજકોટમાં “Asian Crane Congress”ની મીરીંગ હતી,

જેમાં દેશ-વિદેશના તજશો આવેલાં. ઘણાં સૂચનો આવ્યા અને આજે માત્ર ૧૨ વર્ષમાં સારસની હાલત જુઓ ! તે સૌરાષ્ટ્રમાંથી અદશ્ય થઈ ગયા છે. આજે આપણે ત્યાં ઘાસિયા પ્રદેશોની હાલત જુઓ ! તેને પડતર જમીન (wasteland)ની જેમ રાખવામાં આવે છે. આપણે ક્યાં સુધી હાથ પર હાથ રાખીને બેસી રહીશું ? શું પક્ષીઓની યાદી કે પક્ષીગણતરી કરવાથી આ પક્ષીઓની જાતો કે તેઓના આવાસો બચી શકશે ? તેઓનું પ્રજનન શક્ય બનશે ?


આથી મિત્રો, આપણે માત્ર પક્ષીનિરીક્ષક ન બની રહી એક પ્રકૃતિસરકાર બનવું પડશે. પક્ષીઓનાં રહેઠાણ તથા તેઓના વિસ્તારોને બચાવવાના પ્રયત્નો કરવા પડશે. દેશી ઘટાટોપ વૃક્ષો (વડ, પીપળ, લીમડો, બહેડો, ચરલ, હલદરવો, બાવળ, સાદડ) વાવી ઉછેરવાં પડશે કે જેથી, શિકારી પક્ષીઓ કે અન્ય પક્ષીઓ ત્યાં માળો બાંધી શકે. હું પક્ષીનિરીક્ષક પક્ષીગણતરી કે, પક્ષીની યાદી બનાવવાનો વિરોધી નથી પરંતુ આવી પ્રવૃત્તિઓ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ, જે આપણામાંના ઘણાં ભૂલી ગયા છે, તેને યાદ અપાવવાની કોશિશ કરું છું. આજે તમામ જાતિની ગણતરી કરવાને બદલે જે જાતિઓ ભયમાં મુકાયેલી છે તેમની જાતરી કરવી વધારે જરૂરી છે, જેથી સમય, શક્તિનો ઓછો વ્યય થશે અને ફાયદો વધુ થશે.

મિત્રો, શું આપણે બધાં એકજૂથ થઈને આપણાં જળખાવિત કેન્દ્રો, ઘાસનાં વીડો તથા જંગલોને બચાવવા કરી શકીએ? જે આજે આપણે આ બાબતની ગંભીરતાથી નોંધ નહીં લઈએ તો કદાચ ચિલોત્રા (Grey Hornbill), સારસ, ધોરડની જે હાલત આપણાં રાજ્યમાં થઈ તેવીજ હાલત, ખડમોર, ટિલોર, રાજગીર (King Vulture), જેવી અનેક જાતોની થશે.

ગૌરોંગ જોખી

નાની બજાર, સટોઉયા સ્ટ્રીટ, ગોડલ-૨૬૦૩૧૧

\*\*\*



## અસામાન્ય પક્ષીઓની હાજરી અને ગેરહાજરી વિષે

'વિહંગ' અંક ૧૩, પૃ. ૧૫ ઉપર લાલસિહભાઈ રાઓલે કેટલીક નોંધ ઉપર મારી ટિપ્પણી માંગી હતી. તેના અનુસંધાનમાં જાણાવવાનું કે, આજ અંકમાં મારો સહજ પ્રતિભાવ પ્રગટ થયો છે, જેમાં ઉત્સાહી, યુવાન પક્ષીનિરીક્ષકો વધારે સંયમ દાખવે તો પોતાની પ્રતિભા વિષે, તે વાત મેં કરી છે. આ ત્રણેય નોંધ સ્વીકારવા માટે હું અચકાઉં છું. તેના કારણ નીચે મેમારો છે.

\* 'Whitebreasted Laughing Thrush' (હસતું લેલું) જો ગુજરાતમાં ખરેખર આવે તો એક વિક્રમ ગણાય કારણ કે, નોંધિલ વિસ્તાર, દક્ષિણમાં પશ્ચિમધારના ભારે વરસાઈ જંગલો છે. કષાટકના બ્રાંબળિરિ પર્વતની ઉત્તરે આ પક્ષી જોવા મળ્યું નથી. વધારે ઉત્તર તરફ હાજરી હોય, પણ ગુજરાતમાં વધારે દૂર છે.

\* 'Whitebreasted Flycatcher' પણ પશ્ચિમધારનાં બેજવાળા જંગલોનું પક્ષી છે. લોનાવલાથી થોડે ઉત્તરે ભીમાંંકરથી દક્ષિણા ઘાટોમાં રહેતું આ પક્ષી ગુજરાતમાં મળી આવે તે સંભવિત છે, છતાં વધારે નિરીક્ષણ માંગી લે છે.

\* 'Firebreasted Flowerpecker' ગુજરાતમાં કોઈ સંજોગોમાં મળે નહીં. કારણ કે, તે દિમાલયનાં જંગલોનું પક્ષી છે. ઉનાણામાં ૩૦૦૦મી.ન્ની ઊંચાઈ સુધી દેખાય, જ્યારે શિયાળામાં તળેટીના પ્રદેશમાં ઊતરી આવે. કોઈ ખૂબ થઈ લાગે છે.

યુવાન પક્ષીનિરીક્ષકોને ભારપૂર્વક સલાહ આપવી જરૂરી છે કે, ઉત્સાહ કાબૂમાં રાખી કોઈ પણ નવી નોંધ કરતાં પહેલાં ખૂબ ચોકસાઈથી નિરીક્ષણ કરવું.

થોડા દિવસો પહેલાં, વડોદરાથી રાજુ વ્યાસ મને મળવા આવેલા. મુખ્યત્વે મારે સાપો બાબત માહિતી તથા સલાહ જોઈતાં હતાં, છતાં પક્ષીઓ બાબતે વાત સહેજે થાય. તેઓએ ત્યાં કંચી પિંડો (Brown Chat) જોયો હતો, તેની જાણ કરી. પહેલા પણ વડોદરામાં આ પક્ષીની નોંધ થઈ હતી, જે 'વિહંગ'માં આ અગાઉ પ્રસિદ્ધ થયું હતું. આમ વડોદરા ખાતે બે અલગ જગ્યાએ આ પક્ષી હોવાનું સ્પષ્ટ થયું. વધારે જોડીએ ત્યાં હશે જ. સાથેસાથે, ગાંધીનગર પાસે વાવોલ

ખાતે આ પક્ષી જોયાની જાણ ભાવનગરના શ્રી નવનીત ભંડે 'વિહંગ'ના છેલ્લા અંકમાં કરી હતી. પક્ષીના શોખીન મિત્રો દરેક દેવયકલીની માદાને બીજી નજર અચૂક આપે. ગુજરાતમાં આ પક્ષીનો વ્યાપ કેટલો છે તેનો અંદાજ આવે.

પ્રાચીન કાળમાં, ગુજરાતના પૂર્વ કુંગરાઓ ઉપર છેક અર્બુદાચલ સુધી ગીય વનરાઈ હતી અને આ એક સંંગ અરણ્ય, દક્ષિણ સહ્યાદ્રિની સાથે જોડાયેલું હતું. હવે આ વનપ્રદેશ ચૂંથાઈ ગયો છે અને અલગ અલગ ટૂકડાઓમાં, તેમાં વસતી પક્ષીઓની સ્થાનિક જાતિઓ ટકી રહી છે. આવા રહ્યાસહ્યા ટૂકડાઓની નોંધ કરી તેમાંની વનસ્પતિનું જતન કરવું, એ એક અમૂલ્ય કામગીરી થશે. વૃક્ષારોપજ કરવા કરતાં કુદરતી વનસ્પતિનું સંપૂર્ણ રક્ષણ વધારે સારા પરિણામો આપશે. આ ચોમાસામાં આ વાતની સ્પષ્ટ સમજજ્ઞા, હિંગોળગઢના મોતીસરીના જંગલમાં જોવા મળે છે. રક્ષણનું ખૂબ જ સુંદર કાર્ય થયું છે અને વરસાદ ઓછો પડવા છિતાં ઘાસ અને વનસ્પતિ કૂલિઝાલી છે. આ કામ માટે જંગલખાતાના કર્મચારીઓને ખરેખર બિરદાવણા જોઈએ. જો બે મહિનાની સચોટ કામગીરી હિંગોળગઢ જોવા કુંગરાણ પ્રદેશમાં જ્યાં વરસાદ અનિયમિત છે તથા પવન વધારે છે, ત્યાં આ પરિણામો સર્જ તો બીજા વિસ્તારોમાં કેટલી હંડે વનઅબાદી ઊભી કરી શકાય !

પોરબંદરના ભરત રૂધાણીએ મને ખલીલિની ત્રણ તસવીર બતાવી અને સ્લેન્ડરબિલ્ડ ખલીલિ (Slenderbilled Curlew) હોવાની શંકા વ્યક્ત કરી. મોટી અને નાની ખલીલિ (The Curlew and Whimbrel)ને તો આપણે ઓળખીએ છીએ, પણ સ્લેન્ડરબિલ્ડ ખલીલિ એ ત્રીજી જાત છે અને તસવીર શંકસ્યદ હતી. આ નોંધ ગુજરાત અને ભારત માટે ખૂબ જ અગત્યની છે, ખાસ તો એટલા માટે કે, આ જત વિશ્વમાં ઓછી સંખ્યા ધરાવે છે. વધુમાં ભરતે એમ પણ જાણ કરેલ કે, જ્યાં આ તસવીર લીધેલી ત્યાં આ પક્ષીનાં ટોણાં જોયેલાં. ખાસ નોંધ રાખવી કે આ ખલીલિ ઊડતી નજરે નાની ખલીલિ હોય તેવો ભાસ થાય છે. ભરતને મેં સલાહ આપી કે, તેઓ ત્રણેય તસવીરો બી. એન. એચ. એસ. ને મોકલે તથા વિહંગમાં પણ પ્રકાશિત કરે.

(૩૦-૧૧-૦૧)

વિહંગ  
ગાંધીનગર

## જી શહેરી પક્ષીઓની દોડપામ !

'વિહંગ'ના શરદ ૨૦૦૧ના અંકમાં શાંતિભાઈ વરુની કાળી કંકણસારના વીજ થાંબલા પરના માળા વિશેની નોંધ વાંચી. હાલના સમયમાં જાડ મોટાં પ્રમાણમાં, ડેર ડેર કપાઈ ગણા હોવાથી અમુક પક્ષીઓ વીજળીના ઊંચા થાંબલા પર પોતાના માળા બાંધે છે. મેં કાગડા, ઘેણવો ગુમ્બસ (Tawny Eagle) જેવાં પક્ષીઓના માળા આવા ઘડા થાંબલા પર જોયા છે. કંકણસાર ઘડી વાર બીજાં પક્ષીઓના જૂના માળાનો ઉપયોગ કરતી હોય છે. કંકણમાં મેં કંકણસારને નાણિયેરી પર માળા કરતાં જોઈ છે. મારી પોતાની વાડીમાં આંબલી, લીમડા વગેરેનાં મોટાં જાડ છે, પરંતુ કંકણસારની એક જોડી દર વર્ષે નાણિયેરીમાં પોતાના માળો બાંધવાનું પસંદ કરે છે. આ વર્ષે એક બાંધું ઉર્ફેર્હું હતું.

ગણા મહિને હું બિમાર થતાં મારે મુંબઈની 'શ્રીય કેરી' ઇસ્પિતાલમાં દાખલ થયું પદ્ધતિ. મારા ઇસ્પિતાલના ઓરડાની બારીમાંથી દરરોજ પક્ષીનિરીક્ષણ કરતો. ત્યાં સમડી (Pariah Kite), કાગડો અને ગિરનારી કાગડો (Jungle Crow) મોટાં પ્રમાણમાં જોયા. એક સમડીની જોડી, સામે એક મોટા બહુમાળી મકાનની બારીમાં ગોક્કેલ 'એરકન્ડીશન' પર માળો બાંધી મેં જોઈ. ઇસ્પિતાલના પ્રાંગણમાં અમુક જાડ હતાં, પણ તેના કરતાં અનેકગણી વધુ ઊંચાઈ પરાવતા મકાનને આ પક્ષીઓએ પસંદ કર્યું, તેમ મને લાગ્યું. થોડું વર્ષો અગાઉ મેં મુંબઈમાં અમારા છંદ માળે આવેલ ફેલટમાંથી સામેના એક બહુમાળી મકાનના ગરૂખા (Garukha)માં લોકાની જાળી છે, તેમાં કાગડાને માળો કરતાં જોયા.

ઇસ્પિતાલની બારીમાંથી આ જે દૃશ્ય હું જોતો તેના પરથી એવું લાગ્યું કે, શહેરમાં રહેતાં માળસો, જેમ પોતાના કામમાં વ્યસ્ત, આમતેમ જડપથી ચાલ્યા કરે, તેમને

(અનુસંધાન પા. નં. ૨ ઉપરથી)

સંખ્યા પર અંકુશ રાખે છે તેનું લેખકો જણાવે છે. આવાં માંસઅલ્પી ચામાચિરીયા (Vampire Bats) ઉત્તર ગુજરાતમાં થતા હોવાનું મી. કેવે નોંધું છે ખરું, પણ ગુજરાતમાં બધેતે છે? હોય તો કેટલાં? મને આનો અનુભવ નથી. 'વિહંગ' ના વાયકેમાંથી કોઈને હોય તો જરૂર જણાવે. લેખકો લાખે છે, જે કોઈ ગિરનાર ગણું હશે તેને એની બેંકાર ખીંચો માથેની ઢૂંઢો પર અસંખ્ય, એકસોથી માંડી હજાર હજાર ગીંધોની હારમાળા નજરે ચડ્યા વિના નહીં રહી હોય." શ્રી લવકુમાર ખાચરનો અનુભવ છેકે, ગુજરાતમાં દેખાતાં બધી જાતનાં

નિરાંતે ઊભા રહી એકબીજા સાથે વાતો કરવાનો પણ સમય ન હોય, તેવી રીતે 'શહેરી' પક્ષીઓ પણ આમતેમ ઊડ્યાં જ કરતાં હતાં. જેવી રીતે કુદરતી માદોલમાં પક્ષીઓ જાડ પર જરા વાર બેસે, વિરામ કરે, પાંખો અને પીછાં ચાંચ વે સાફ કરે, તેવી રીતે એ શહેરી પક્ષીઓને નિરાંતનો સમય જ ન હોય તેવો મને ભાસ થયો. સામાન્ય રીતે સમડીને ઊંચે ઊડવાની પાંખો સ્થિર રાખી ચક્કર લગાવવાની ટેવ હોય છે, પરંતુ કુદરતી માદોલમાં તે થોડો સમય બેસતી હોય છે. તેથી વિપરીત શહેરમાં રહેતી સમડી ઊડ્યા જ કરતી હતી અને થોડી વાર કોઈ ઊંચા પાઈપ કે અગાસીની પાળી પર બેસે, પણ પછી તરત જ તેનું ઉક્યન ચાલુ કરી દે. ફક્ત જે સમડી 'એરકન્ડીશન' પર માળો બાંધતી હતી તે નાણિયેરી અને બીજા જાડ પર ઊતરી સળીઓ તોડતી મેં જોઈ. કબુતરો પણ વારંવાર એક મકાન પરથી બીજા પર ઊડતાં જ રહેતાં મેં જોયાં. આમ શહેરી મનુષ્યોની જેમ પક્ષીઓની પણ એ ફૂન્ઝિમ વાતાવરણમાં હિન્દયર્યા નિહાળવાનો મને મોકો મળ્યો.

આ લખાણની શરૂઆત પંખીના માળાના વિષયથી કરી. છેલ્દે, આજથી બાવન વર્ષ પૂર્વે નોથેલ પંખીજગતની ઘટના યાદ આવી જતાં, તેનો અહીં ઉલ્લેખ કરું છું. અમારી કલબમાં એક નીલગિરિનું સુકાઈ ગેયે ઊંચું વૃક્ષ હતું, જેના પર સને ૧૯૪૮નાં એક કાગડાની જોડીએ માળો બાંધેલ. બીજું સેલા (1948), શિકરાની જોડીએ તે માળો, તેમની પ્રજનન જતુમાં પસંદ કર્યો. આ પછી એ જ માળાનો વધારે બાંધકામ કર્યા બાદ કાળી કંકણસારે (Black Ibis) ઉપયોગ કર્યો! એ જ અરસામાં કાગડાએ રણજાતવિલાસ પેલેસની અગાસીમાં પથરની ધૂમંટીમાં બચ્ચાં ઉછેર્યા હતાં. તે સમયે ભુજમાં જાડનો અભાવ હતો.

મ.કુ.દિંમતસિંહજી, ભુજ

ગીધ ઠીક ઠીક સંખ્યામાં તાં જોવા મળે છે, પણ હજારોની સંખ્યામાં? આજે ગીધની દશા કેવી છે? ગીધ હવે દુર્ભિદર્શન થવા લાગ્યાં છે. ક્રેપલને લેખકોએ સંપૂર્ણ શક્કાદારી કંઈ છે તે બચાબર નથી. નાનાં પંખીઓનાં હંડાં ગણી જતી ઘણાએ તેને જોઈ છે.

આવા થોડા હડીકત- દોષો બાદ કરતાં પંખીઓ વિશેનું આ પુસ્તક તેની નવતર રજૂઆત, લખાણની શૈલી અને પક્ષીઓ અંગે આપેલ પ્રચૂર વીગતોને લીધે પક્ષીપ્રેમીઓએ વાંચવા જેવું છે.

સી-૨, હરિઅમ એપાર્ટ., 'ટાઈસ ઓફ ઇન્ડિયા' પ્રેસ રોડ,  
જીરાજ પાર્ક, અમદાવાદ-૫૩.

## ખડકોર : કામપકા વીડીના વિજ્ઞોષ કંઈબી સાથે

જો કોઈ ગામની આસપાસ ધાસનાં નાનાં મોટાં બીડ હશે અને રક્ષિત હશે તો, ત્યાંના રહીશો આ પક્ષીથી અજ્ઞાત નહિ હોય. લગભગ દેશી કુકડાના કદનું આ પક્ષી તેની વિશિષ્ટતાઓ, ખાસિયતોને લઈને જ નામશેષ થવામાં છે. આજથી ૧૨૦ વર્ષો પૂર્વ, જ્યારે આ પક્ષીની સંખ્યા ખાસ્સી હતી ત્યારે, બે પક્ષીપ્રેમી અંગેજે, સુમ અને માર્શલે ૧૮૭૮માં લખેલું, “આ સુંદર પક્ષી તેની ખાસિયતોને લઈને શિકારીઓમાં ‘ગેમબર્ડ’ તરીકે જે રીતે ચિપ છે અને તેનો જે રીતે શિકાર થાય છે, તે જોતાં હવે પછીનાં ૫૦ વર્ષોમાં તો તે લગભગ નાશ પામી ચૂક્યાં હશે.” દોસ્તો, ૧૨૦ વર્ષો આ વાતને થઈ ગયાં છતાં આપણો આ પક્ષી જોઈ શકીએ છીએ. આપણે નસીબદાર છીએ, કદાચ હવે પછીની પેઢી આપણા જેટલી નસીબદાર નહીં હોય !

એક તબક્કે આ પક્ષી ગુજરાતમાં કેર કેર જેવા મળતાં હતાં, હવે તો અમૃક મર્યાદિત સ્થળોએ અને તે પણ જૂઝ સંખ્યામાં જોવા મળે છે. ‘Bombay Natural History Society’ એ આ પક્ષીની મહત્ત્વાની સમજી, સ્વીકારીને તેના અંગે અભ્યાસ, ૧૮૮૮માં શરૂ કર્યો હતો. ૧૮૮૦માં પૂર્ણ થયેલા અભ્યાસને અંતે જે માહિતી આપણને મળી છે તે ખરેખર દરેક પક્ષીપ્રેમીએ જાણવા જેવી છે. (Status and Ecology of the Lesser Florican and Bengal Florican - BNHS - 1990)

રામપુરા ધાસબીડ, ઘઢોદથી દ કિ.મી. દૂર છે અને દીદોર - વડોદરા ‘હાઇવે’ને અરીને આવેલું છે. આ ધાસબીડ ગુજરાતનાં સંહૃદી મોટાં ધાસબીડો પૈકીનું એક છે. તેનો વિસ્તાર ૨૨૦૦ હેક્ટર જેટલો છે. ૧૯૮૫ની સાલથી પ્રકૃતિ ભિત્ર મંદળ, દાહોદના સંખ્યો લગભગ દરેક વર્ષ, આ પક્ષીનું સર્વેક્ષણ કરતા આવ્યા છે. દરેક વર્ષ ખડમોર ઓછા-વત્તા આવ્યાં તો છે જે. તેઓની સંખ્યાનો આધાર વરસાદ પર છે. દુલ્લગણનાં વર્ષોમાં ૨-૩ પણ જોયા છે, જ્યારે સારા વરસાદમાં સરેરાશ રૂપ થી. ઉપ પણ જોયા, નોંધાયા છે. આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે, કારણ કે, અહીંનું ધાસબીડ વિશાળ હોઈ સમગ્ર વિસ્તારનું એક સાથે સર્વેક્ષણ કરવું મુશ્કેલ છે. અમે લોકોએ મહત્તમ, છુટ ખડમોર ૧૮૮૮માં નોંધાયા હતાં. રામપુરા ધાસબીડ ઉપરાંત દાહોદની આજુબાજુનાં છૂટાંછવાયાં

ધાસબીડો જેવાં કે, નવાગામ, બોરડી, ખોડવા, ખડકા વિ. વિસ્તારોમાં પણ ખડમોર છૂટાંછવાયા દેખાય છે. આ બધા વિસ્તારો આદિવાસી વસ્તીથી વેરાયેલા છે, અને આદિવાસીઓ આ પક્ષીની મહત્ત્વાથી અજ્ઞાત હોઈ, ખાસ્સો શિકાર થાય છે.

પ્રકૃતિ ભિત્ર મંડળના સંખ્યોએ ૧૮૮૮ની સાલમાં તે વખતના અહીંના RFO શ્રી હેમતભાઈ સુથાર તથા વનવિભાગના સહયોગથી ખડમોરને ‘રીંગ’ પહેરાવી હતી, પરંતુ હજુ સુધી એ ‘રીંગ’ની કોઈ વળતી નોંધ મળી નથી.

આ પક્ષી ચોમાસામાં ફક્ત આપણા ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્યમદેશમાં અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આવે છે. આપણે ત્યાં પ્રથમ વરસાદમાં આવી જાય છે (અભાદ્રૂન). અહીં આવે છે ત્યારે ધાસ પૂરતું ઊર્ધ્વાંસી હોતું, તેથી નજીકના જેતરમાં કે નાનાં જાડી-જાંખરામાં તે છુપાઈ રહે છે. આપણે ત્યાં તે જૂનથી માંડીને ઓકટોબરનાં અંત કે નવેમ્બરની શરૂઆત સુધી રોકાય છે, પ્રજનન કરે છે. બાકીના મહિનાઓ નવેમ્બરથી જૂન સુધી, એટલે કે શિયાળો અને ઉનાઓ, તે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહારનાં ગંગાનાં મેદાનો, ઉત્તરપદેશનાં તરાઈનાં મેદાનો, નેપાળ અને દક્ષિણમાં આંધ્રપદેશ, કર્ણાટક સુધી છૂટા છવાયા ફેલાઈને રહે છે.

ખડમોર તેની ખાસિયતો અને વિશિષ્ટતાઓને લઈને જ વર્ષોથી પક્ષીવિદો, શિકારીઓ અને સામાન્ય લોકોને આકર્ષણું આવ્યું છે. જહાંગીરે પણ આ પક્ષીની નોંધ કરી છે. અંગેજેએ પણ તેના વિશે લખ્યું છે. અહીં પંચમહાલમાં આ પક્ષીની પહેલી નોંધ ૧૯૭૧માં બેકરે કરી હતી.

આપણા પક્ષીવિદું સ્વ. ધર્મકુમારસિંહજાને તેઓના પુસ્તક ‘Sixty Indian Birds’ માં આ પક્ષી અંગે ખાસ્સી માહિતી આપી છે. આ પક્ષી માટેનું તેઓશ્રીનું અવલોકન અને અભ્યાસ ખરેખર દાદ દેવા યોગ્ય છે. તેઓશ્રીએ છેક ૧૯૪૫માં ખડમોરને ‘રીંગ’ પહેરાવીને તેની જાણકારી મેળવવા પ્રયત્નો કર્યા હતા.

‘પંખીજગત’માં, સ્વ. પ્રદુભન કંચનરાય દેસાઈએ પણ ખડમોર અંગે સુંદર માહિતી આપી છે.

BNHSના ખડમોરના 'ગ્રોઝેક્ટ'ના અનુસંધાનમાં શ્રી રવિશંકરન્દુ, શ્રી અસદ રહેમાની અને અંતમાં શ્રી નટરાજને આ પક્ષી માટે ખૂબ જ ઊંડાળપૂર્વક અભ્યાસ કર્યો છે. તેના અનુસંધાનમાં જ ૧૯૮૪માં ડિસેન્સની રજી તથા ઉજી તારીખે વડોદરામાં ખડમોર ઉપર કાણિશબિસું આયોજન કરવામાં આવ્યું હતું. ખડમોરની ઘટતી જતી સંખ્યા ઉપર ખૂબ જ ગંભીરતાથી વિચારણાઓ થઈ હતી. કેટલીક સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ, છુટુછલાયું થોડું કામ થયું પણ હશે, પરંતુ આજે કશી માહિતી મળતી નથી. છલ્લા આંકડા પણ મળતા નથી. ૧૯૮૦માં આ પક્ષીની સંખ્યા ૪૫૦૦ હતી. ૧૯૮૪માં ૨૨૦૦ની આસપાસ હતી. ખડમોર માટે જ અભ્યારણ્ય હોય એવાં બને અભ્યારણ્ય મધ્યમદેશમાં છે, સેલાના ખડમોર અભ્યારણ્ય તથા સરદારપુર ખડમોર અભ્યારણ્ય. અહીં રામપુરામાં પણ જૂનથી નવેન્ભર સુધી ધાસબીડની ચોકી માટે વનખાતા તરફથી ચોકીદારો નિયુક્ત થતાં હોઈ આ દિવસો પૂર્તું ખડમોરને રક્ષણ મળી રહે છે.

૧૯૭૨ના 'Wildlife Protection Act, ૧૯૭૨'ના મુજબ ખડમોરને સંપૂર્ણ રક્ષણ આપવામાં આવ્યું છે. આ પક્ષીનાં પકડવા, મારવા તથા શિકાર કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે.

આ પક્ષીની વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી માટે ૧૯૮૪માં BBCની 'ટીમ દાહોદ' ખાતે આવી હતી. સુરતના શ્રી મુકેશ ભકે તથા 'પ્રકૃતિ મિત્રમંડળ', દાહોદના સભ્યો, શ્રી સૈફીભાઈ કડીવાલા તથા ડૉ. મેહુલ શાહે પણ ખડમોરની સુંદર વિડીયોગ્રાફી - ફોટોગ્રાફી કરી છે.

આપણે હવે આ પક્ષી અંગે ટૂકડાં જાહીરે.

ખડમોર એ Otididae કુળનું પક્ષી છે. આ કુળનાં પક્ષીઓ ૪૦૦-૫૦૦ લાખ વર્ષોથી પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે, તેવું તેના જૂનામાં જૂના અશ્ચ અવશેષો પરથી ફિકિત થાય છે. ભારતમાં આ પક્ષીના કુળની જ જાતિઓ જોવા મળે છે.

૧. ધોરડ (Great Indian Bustard, *Ardeotis nigriceps*)
૨. ખડમોર (Lesser Florican, *Sypheotides indica*)
૩. બેંગાલ ફ્લોરિકન (Bengal Florican, *Houbaropsis bengalensis*)

૪ ટિલોર (Houbara Bustard, *Chlamydotis undulata*)

ઉપરનાં ૪ પૈકી પ્રથમ ત્રણ, ભારતનાં સ્થાપી નિવાસી છે, જેમનાં અસ્તિત્વ જોખમમાં છે, જ્યારે છેલ્લું, શિયાળું મુલાકાતી છે.

ખડમોર, તેની અન્ય જીતોની સરખામણીમાં સહૃદી નાના છે. નર ખડમોર પુખું હોય તો લગભગ ૪૫ સે.મી. અને માદા ખડમોર પુખું હોય તો ૫૭ સેમી. ઊંચા હોય છે. નર કરતાં માદા ઊંચી હોય છે. સરેરાશ વજન ૫૦૦ થી ૭૦૦ ગ્રામ જેટલું છે. પ્રજનનજીતું સિવાયનાં દિવસો દરમિયાન નર માદા બચે, દેખાવમાં સરખા લાગે છે, સિવાય કે નરની પાંખોનાં સફેદ પીંછા. પ્રજનનજીતું નરનો દેખાવ ખૂબ જ રૂઆબાદાર લાગે છે. આ દિવસો પૂરતાં, નરની ગરદન, છાતી, પેટાન અને આંખો પાસેના કલગી જેવાં પીછાં, કણા રંગના હોય છે. પાંખોની ઉપરના ભાગમાં તપખીરિયા રંગનું ચીતરામણ હોય છે. પગ લાંબા અને જાંપા પીળાશ પડતા અને આંખો વેરી કંચ્ચરી હોય છે. ચાંચ ખૂબ તીક્ષ્ણ, મેલા લીલા ચટની રંગની અને તેની ડિનારી પીળાશ પડતી હોય છે. એના ખબા પાસેથી સફેદ પણો શરૂ થાય છે, જે પાંખના છેડા સુધી પહોંચે છે. માદા એક સરખા તપખીરિયા રંગની હોય છે. તેના ઉપર કાળી ભાત હોય છે. પ્રજનન સમય પૂરો થતાં નર-માદા બંને સરખા દેખાય એ ફક્ત નરની પાંખ ઉપરનો સફેદ પણો, અલગ ઓળખ આપે છે. આમ તો આ પક્ષી ખૂબ જ શરમાળ છે. જેમ જેમ તેની નજીક જઈએ, તેમ તેમ લપાતું છુપાતું તે દૂર ને દૂર જરૂર જાય છે. પગ લાંબા હોવાથી ચાલવામાં ખૂબ જ ચંપણ અને ઉતાવળિયું છે, ઊડવાનું ન છુટકે જ રાખે છે. માદા તો ભાગે જ જોવા મળે છે. ખૂબ તપખ્યાર્યા કરીએ અને સંજોગો અનુકૂળ હોય તો જોવાઈ જાય.

એક મોટો વરસાદ થતાં જ તેમનું આગમન શરૂ થઈ જાય છે. આવતાંની સાથે જ નર પોતાની ક્ષેત્ર - મર્યાદા (territory) ઓડિન્ટ કરે છે. આવી ક્ષેત્ર - મર્યાદા ધાસબીડનાં ક્ષેત્રફળ અને નરની સંખ્યા પર આધારિત છે. રામપુરા ધાસબીડ વિશાળ હોઈ આવી ક્ષેત્ર મર્યાદા ૧ થી ૨ હેક્ટર સુધીની રહે છે, જ્યારે વેળાવદર રાખ્યી ઉદ્ઘાનમાં આવી ક્ષેત્ર - મર્યાદા ૧૦૦ મી.ની આસપાસ રહે છે. એક વખત ક્ષેત્ર - મર્યાદા નક્કી

થયા પછી તેમાં તે અન્ય કોઈ નરને પ્રવેશવા દેતો નથી. તે સ્વભાવે કજિયાખોર બની જાય છે અને ક્ષેત્ર અધિકાર માટે ઘણી વાર લડતા પણ દેખાય છે. ક્ષેત્રની અંદર જ કોઈ ઊંચી જગ્યાએ તે તેનો અડો જમાવે છે અને ડેકડા - ફૂદકા મારવાનું શરૂ કરે છે. આ માટેનું મુખ્ય કારણ માદાને આકર્ષવાનું જ છે. માદા ક્યારેય ફૂદકાં મારતી નથી. ઘણી વાર એક નર તેના ક્ષેત્રમાં ફૂદતો હોય તો તેની દેખાડેખીથી નજીકના ક્ષેત્રનો નર વધુ ને વધુ ફૂદકા મારે છે. ઘણી વાર અલગ અલગ ક્ષેત્રનાં ઉ-ઝ નર એક સાથે ફૂદકા મારતાં જોવાય છે. આમ તો ફૂદકા મારવાનું વહેલી સવારે કે સાંજના હોય છે, પરંતુ વાદળાયા વાતાવરણમાં નર ખડમોર આખો દિવસ ફૂદકા માર્યા કરે છે. આવો ફૂદકાઓની સંખ્યા ક્યારેક હિવસમાં ૫૦૦ સુધીની હોય છે (Conservation of the Lesser Florican - Ravi Shankaran). ફૂદકા, ૧.૫ થી ૨ મીટર સુધીની ઊંચાઈના હોય છે. એ કૂદું છે ત્યારે, જે જગ્યાએથી ફૂદું હોય ત્યાં જ પાછું પડે છે અને જમીન ઉપર પાછું પડે છે ત્યારે તેની પાંખો અધિભૂતી હોય છે. આ એક ફૂદકાનો સમયગાળો ૧ સેકડની આસપાસ રહે છે. તે જથારે ઊંચે કૂદું છે ત્યારે, દરૂર્દરૂર્દુર કરીને અવાજ થાય છે. આવો અવાજ તેની પાંખોના પ્રથમ પીછા (primaries)-ની વિશેષ રૂચના થકી થાય છે.

દૂરથી સાંભળતા, આવો અવાજ દેડકાના અવાજ જેવો લાગે છે (Sixty Indian Birds, સ્વ. ધર્મકુમારસિંહજી). ઘણી વાર પોતાના ક્ષેત્રનું ઘાસ ઊંચું થઈ ગયું હોય



તો તે બાજુના ખુલ્લા ખેતરમાં જઈને પણ ફૂદકા મારે છે. માદા જયારે તેની ક્ષેત્ર - મર્યાદામાં પ્રવેશે છે ત્યારે, નર ફૂદકા મારવાનું બંધ કરી માદાને આવકારવા માટે સામે દોડે છે. પ્રજનન સિવાય નર- માદા ભાગ્યે જ સાથે જોવાય છે.

ઘાસની વચ્ચે જ ખુલ્લી પડતી થોડી જગ્યામાં ઘાસનો માળો બનાવી માદા ખડમોર ઈડાં જોડે છે. ઈડાં સામાન્યતઃ ઉથી ૪ હોય છે. કવચિત્ત પ કે એ પણ હોય છે. ઈડાંનો રંગ મેલો લીલો અને તેની ઉપર કથ્થઈ ખબાં હોય છે. ઈડાં લંબગોળાકાર હોય છે. ગર્ભિધાનનો ગાળો રૂપ થી ૨૮ દિવસનો હોય છે. બચ્ચાં, બહાર આવ્યાના એક દિવસમાં તો હરતાં ફરતાં થઈ જાય છે. માદા થોડીક પણ આડીઅવળી થાય તો બચ્ચાં છુપાઈ જાય છે. બચ્ચાં સુકાયેલાં ઘાસમાં એવાં હળીભળી જાય છે, એકદમ નજીક જઈને જોઈને તો પણ જોવતાં નથી. બચ્ચાંના દુશ્મનો મુખ્યત્વે શિયાળ, લોમડી, સાપ, શિકારી પક્ષીઓ વગરે છે.

ખડમોર ખોરાકમાં કશી બાંધછોડ રાખતાં નથી, જે મળે તે આરોગે છે. તમામ પ્રકારની જીવાત, નાના સાપ, તીડ, ઉધઈ, મકોડા, ઢાલીયા, ગરોળી અનાજનાં કુમળાં દૂડાં વિ. આરોગે છે.

ચોમાસું પૂરું થતાં, ઓકટોબરના પાછળાં દિવસોમાં કે નવેમ્બરની શરતાત્માં તે પરત પ્રયાણ કરે છે. આ સમયગાળામાં ઘાસ સુકાઈ ગયું હોય છે અને ઘાસ વાઢવાનો સમય પણ થઈ ચૂક્યો હોય છે.

અજ્ય મ. ટેસાઈ

પ્રકૃતિ, ૨૪ વૃદ્ધાવન સોસાયટી, શેઠ શ્રી જિરખરલાલ માર્ગ, દાદોદ.



## મ.કુ.હિંમતક્રિણુળની હલમે

\* કચ્છમાં પ્રકૃતિ તથા પંખીઓના અભ્યાસની પરંપરા

શરૂઆતમાં કચ્છ પશુપાલકોનો મુલક હતો. એ પ્રદેશમાં ખેતીનો વિકાસ બહુ થોડા પ્રમાણમાં થયેલો, પરંતુ ધાર્સિયા જમીનો અને વનસ્પતિ વિપુલ પ્રમાણમાં હોવાથી અને મનુષ્યોની સંખ્યા ઓછી હોવાને લીધે જંગલી પશુપક્ષીઓ સારા પ્રમાણમાં હતાં, જેની સાથે પશુપાલન માટે સારો એવો અવકાશ હતો.

લગભગ ઈસુની ૮મી કે ૧૦મી સદીથી સિંધમાં વિપરિત સંયોગોનું નિર્માણ થતાં, ત્યાંના અને અમુક રાજ્યથાનના લોકોએ કચ્છમાં હિજરત કરેલ. આની સાથે કચ્છમાં ખેતીના વિકાસની શરૂઆત થઈ. સાથે સાથે સિંધી, રાજ્યથાની અને અમુક અંશે ગુજરાતી ભાષાના મિશ્રણવાળી કઢી ભાષાનું નિર્માણ થયું. કચ્છના લોકો શરૂઆતથી જ કચ્છની વનસ્પતિ, પશુ-પક્ષી અને વિશાળ કુદરતી માણોલમાં રસ લેતા થયેલા. તે એટલી હંડે કે, વનસ્પતિ અને જવસુદ્ધિનાં નામો પણ ઘડી કાઢેલ, જે આજે પણ પણ પ્રચલિત છે. સૂચિ સાથે કઢીઓનો એટલો તો લગાવ હતો કે, તે તેમના જીવનના પ્રસંગોમાં, કવિતા અને લખાણોમાં, ઉપરાંત, વનવગડાનાં સ્થળોમાં વણાઈ ગયેલ. લગભગ બધાં જ સ્થાનિક પશુપક્ષીને કઢી નામો આપવામાં આવેલ. ટેકરીઓ, પાણીનાં વહેણો ઈત્યાદિનાં પણ નામ પાડવામાં આવેલ. પક્ષીઓમાં ટુલ્બજા (Dabchick), હંજ (Flamingo) ઈત્યાદિ. ટેકરીઓ અને સ્થાનિક ભૌગોલિક સ્થાનોમાં સિંહખટલો (ટેકરી યા કુંગર), સિંહગર (ઝીણા, ravine) વગેરે.

કચ્છના લોકોની માફક રાજ્યપરિવાર અને રાજીવીઓને પણ પક્ષીઓમાં રસ હતો. કચ્છની લોકક્ષા તથા કાવ્યોમાં પક્ષીજગતને વણી હોવામાં આવેલ, જેનો એક દાખલો હંજનો છે જેને રાલાખાના જાનેયા તરીકે વર્ણવામાં આવેલ. તે જમાનામાં રાજ્યપરિવારના લગ્નસંબંધો સિંધના સોઢાઓ સાથે હતા અને સિંધ જતાં મોટા રક્ષાને ઓળંગવું પડતું. ત્યાં અથવા પણ્ણોમ કચ્છના સિંધ તરફ જતા પાણીના માર્ગ પર (સિંધ નહીની એક શાખા કચ્છમાંથી પસાર થતી) મોટી સંખ્યામાં



સુરખાબ (હંજ) મોજૂદ હશે એ પરથી તેમને કોઈ કવિ યા લેખકે જાનેયા તરીકે સંબોધ્યા હશે, તેણું આજે આપણે અનુમાન કરી શકીએ. કચ્છના પૂર્વ ઈતિહાસની કોઈ લેખિત નોંધ નથી, પરંતુ એ હકીકત છે કે, કચ્છના છેલ્લી ચાર પેઢીના રાજીવીઓ પક્ષીજગતમાં ઊરો રસ ધરાવતાં.

કચ્છના રાજીવી મહારાઓ શ્રી પ્રાગમલશ, પ્રકૃતિપ્રેમી હતા. તેની સાથે પંખીઓના પણ અભ્યાસું હતા. તેમણે ભૂજમાં પક્ષીઓનું સંગ્રહાલય સ્થાપવાનો નિર્ણય કરેલ, પરંતુ તે સાકાર પાયું તે પહેલાં તેમનું નાની વયે અવસાન થયું. તેમના પછી તેમના વારસદાર મહારાઓ શ્રી ખેંગારજ પણ તેઓના પિતાની જેમ પ્રકૃતિપ્રેમી હતા. તેમના સમયમાં કચ્છમાં રહેતા એક અંગ્રેજ મી. હુ પેલિને, કચ્છનાં પક્ષીઓ વિશે પહેલું પુસ્તક તૈયાર કર્યું અને છાપાયું. ત્યાર બાદ, ૧૮મી સદીના અંતમાં પેલિનના પુસ્તકમાં લેફ્ટેનાન્ટ સી.ડી. લેસ્ટરે સુધારાવધારા કરી, કચ્છનાં પક્ષીઓના પુસ્તકની બીજી આવૃત્તિ તૈયાર કરવાની શરૂઆત કરી અને તે સને ૧૯૦૪માં પ્રસિદ્ધ થઈ (The Birds of Kutch). ત્યાર બાદ, સને ૧૯૪૩માં તે સમયના મહારાઓ શ્રી વિજયરાજજાએ ડો. સલીમ અલીને કચ્છમાં પંખીઓનું સર્વેક્ષણ કરી લેસ્ટરે લખેલ પુસ્તકની નવી આવૃત્તિ તૈયાર કરવા આમત્રક્ષા આપ્યું. સલીમઅલીને એ કાર્ય સહર્ષ સ્વીકારી ૧૯૪૭-૪૮માં વિસ્તૃત સર્વેક્ષણ કર્યું. આમ ૧૯૪૮માં ફરી એક વાર કચ્છ રાજ્યના પર્યે 'ધી બર્ડ્સ ઓફ કચ્છ'ની ત્રીજી આવૃત્તિ સંપત થઈ.

સને ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં મહારાઓ શ્રી ખેંગારજને ભારતના વન ખાતાના નિવૃત્ત ઉચ્ચ અધિકારી સર પીટર ક્લેટરબકને કચ્છમાં જંગલનો વિસ્તાર વધારવા માટે બોલાવેલ. તેઓએ કચ્છમાં સર્વેક્ષણ કરી, કચ્છ રાજ્યને એક ઘણો જ ઉપયોગી માહિતીસંબંધ અહેવાલ આપેલ. આમ કચ્છના રાજીવીઓએ પ્રકૃતિની માવજત માટે ઉપયોગી અભિગમ આપનાવેલ.

કચ્છમાં પશુપક્ષીઓના અભ્યાસની વ્યવસ્થિત શરૂઆત ૧૮મી સદીમાં થયેલ. પ્રથમ સર્વેક્ષણ અને અભ્યાસ એક

## મ.સુ.હિમતક્રિષ્ણલાંજી છલાંગે

ભૂસ્તરશાસ્ત્રી ડૉ. ફાર્નન્ડ સ્ટોલિક્ઝ્રકાએ કરેલ. તેમણે જે પંખીઓ જોવા તેની નોંધ 'એથેટિક સોસાયટી, બેંગોલ'ના 'જર્લિં'માં ૧૮૭૨માં પ્રસિદ્ધ કરેલ. સ્ટોલિક્ઝ્રકા એ નોંધેલા તથા મેળવેલ નમૂનાઓમાંનાં મોટા ભાગનાં પક્ષીઓનાં નામ 'અખીલ ભારતીય કોગ્રેસ'ના પ્રણેતા અને પ્રખર પક્ષીવિદુ એ. ઓ. હુમે આપેલ હતાં. અહી એ બાબતનો ઉલ્લેખ કરું કે, ભારતીય ઉપખંડમાં એક પિંડ (Bushchat)ની પ્રથમ નોંધ કચ્છમાં થઈ હતી. સ્ટોલિક્ઝ્રકાએ તે પક્ષીના ને નમૂના મેળવેલ, એક ભુજ પાસેથી અને બીજો રાપર તાલુકામાંથી. એ નમૂનાનું તેમણે ગ્રીષ્મવટથી વર્ષન કર્યું, જે ઉપરથી તેનું નામ Stoliczka's Bushchat (*Saxicola macrothrynscha*) પાડવામાં આવેલું. હાલ તેની નોંધ જેસલેમેર સિવાય આપણા ઉપખંડમાં હજુ સુધી ક્રાંતિ પણ ચોક્કસ રીતે થઈ હોય તેવું મને જ્ઞાનવામાં આવ્યું નથી. આમ, કચ્છ સહિત આ પક્ષી તેના અગાઉનાં રહેઠાજોથામાંથી લુંખ થયેલું જ્ઞાન છે. મેં સાંભળ્યું છે કે, વેળાવદરના કાળિયાર અભયારણ્યમાં આ પિંડો જોવામાં આવ્યો હતો અને હાલ, શ્રી આર. ડી. જોડેજાએ કરેલ વર્ષન પરથી એ પક્ષી હોઈ શકે, પરંતુ નાળિયા પણે તેને બરાબર જોયા એળાખ્યા બાદ, એ બારામાં ચોક્કસ કદી શકાય. એ ખાનિક નિવાસી પક્ષી છે, જેને મેં પોતે હજુ સુધી કચ્છમાં જોયું નથી.

કચ્છમાં 'પોલિટિકલ એંજેટો' અને બીજા અંગ્રેજ અવિકારીઓ પૈકી અમુક લોકોએ પણ સમય સમય પર પંખીઓની નોંધ કરેલ. તે ઉપરાંત, કચ્છ રાજ્યએ સર જેફ્ફ આર્ચરની સેવા લીધેલ. તેઓનું મુખ્ય કાર્યક્રમ કંડલા બંદરની આસપાસ હતું, જ્યાં તેઓ રાજ્યના મીઠુ - ઉત્પાદનના ઉદ્યોગ પર દેખરેખ રાખતા. સર જેફ્ફ, એક સમયે સોમાલીલેન્ડના ગવર્નરના હોદા પર હતા, જ્યાં તેમણે પક્ષીઓનો ઊડો અભ્યાસ કરેલ અને 'ધી બર્ક્સ ઓફ સોમાલીલેન્ડ' પુસ્તક તૈયાર કરેલ. કચ્છમાં તેઓએ પણીના નમૂના (specimen) મેળવ્યા હતા અને ઈંડાં પણ એકાં કરેલ. તેમણે નમૂના તો બ્રીટીશ ઘૂગ્ઝીયમાં આપી દીધેલ, પરંતુ અલગ અલગ પક્ષીઓનાં ઈંડાં 'બોઝે નેચરલ હિસ્ટ્રી સોસાયટી'ને અર્પણ કરેલ.

અંગ્રેજ અફસરો પૈકી, બ્રિટિશ લાશકરના કેપ્ટન બટલર એક હતા, જેમણે મોટે ભાગે આખું અને ડિસા સુધી પંખીઓની યાદી તૈયાર કરેલ. એ યાદી પોતાની નોંધ સાથે હુમે, ૧૮૭૫

ને ૧૮૭૬માં 'સ્ટ્રેટ્ફર્સ' નામના જર્નલમાં પ્રક્રિય કરેલ. કેપ્ટન બટલરે કચ્છની મુલાકાત ફક્ત એક કે બે વાર લીધેલ. શંખલા (Crab Plover)-ની કચ્છમાં પહેલી શોધ તેમોએ કરેલ. ત્યાર બાદ, ધર્મકુમારસિંહજીએ આ પક્ષી જીવો પાસે નોંધું હતું. હવે તો તે કચ્છના અભાતમાં હજારોની સંખ્યામાં જોવા મળે છે. ધર્મકુમારસિંહજીએ એવો અભિપ્રાય વક્ત કરેલ કે, પશ્ચિમ કચ્છની દરિયાઈ નાળો (creek) માં અમુક ટાપુઓ પર શંખલા નું પ્રજનન થતું હશે.

ડૉ. સલીમ અલીએ સમય પર કચ્છની મુલાકાત લીધેલ. ૧૮૪૩-૪૪ના તેઓના સર્વેક્ષણ બાદ ૧૮૪૫ની સાલમાં તેઓએ હંજના પ્રજનન સ્થળની મુલાકાત લીધી ત્યારે તે પક્ષીઓ ત્યાં હતાં. સાથે સાથે, આપણા દેશમાં પ્રથમ વાર, ગીલટીચાંચ (Avocet)ની ઈંડાં તથા બચ્ચાં જોવાં. ત્યાર બાદ, ૧૮૬૦માં ગુલાબીપેણ (White Pelican)ના માળા અને બચ્ચાં ત્યાં રણમાં હતાં. એ પણ હિંદમાં પહેલી શોધ હતી. ૧૮૭૪માં જ્યારે તેઓ દરભારસાહેબ શિવરાજકુમાર સાથે કચ્છના મોટા રણમાં ગણા તે વખતે, મોટાં હંજ (Greater Flamingo)ની સાથે પ્રથમ વાર નાના હંજ (Lesser Flamingo)નું પ્રજનન નિહાયું. અગાઉ લેસ્ટર વગેરે પક્ષીવિદોનો એવો મત હતો કે મોટાં હંજની સાથે તેના નાના પિતરાઈ બંધુઓ પણ મોટાં રણમાં બચ્ચાં ઉછેરતાં હોવાં જોઈએ, તે મત આપરે સાચો ઢર્યો.

૧૮૫૮માં પહેલી વાર ભુજ પણે જાળીમાં પક્ષીઓને પક્કી પગમાં કરી પદેરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જાળમાં સપાયેલાં પક્ષીઓને કેવી રીતે કાઢવાં, તે 'બોઝે નેચરલ હિસ્ટ્રી સોસાયટી'ના સલ્યો અને કાર્યક્રમોને શીખવવા અને તાલીમ આપવા સ્વીટ્યાર્લેન્ડથી ડૉ. સેફરીલી ખાસ આવેલા. ત્યાર બાદ, તો કચ્છમાં ઘડી બીજી જગ્યાઓમાં આ અભ્યાસ યોજવામાં આવેલ અને તે દ્વારા ઘડીં નવીં પક્ષીઓનો કચ્છની યાદીમાં ઉમેરો થયો. એ પૈકી ખાસ નોંધપાત્ર મસ્કની લટોરા (Grey Hypocolius) હતા. હુવાર બેટમાં શ્રી શેખરે, એ પક્ષીનાં નર અને માદાને પક્કેલ. આ શોધથી ડૉ. સલીમ અલી ઘડીં જ ખુશી થયા હતા. આ પક્ષી આપણા ઉપખંડમાં અતિવિરલ મુલાકાતી લેખાતું, પરંતુ હાલના વર્ષોમાં તે પાકિસ્તાનમાં નિયમિત રીતે જોવામાં આવે છે. કચ્છમાં ૧૯૬૦-૬૧માં 'બોઝે નેચરલ હિસ્ટ્રી

## મ.લુ.હિમતક્રિષ્ણલાલની હલાલો

સોસાયટીને માયાવર પક્ષીઓના અભ્યાસ માટે છારી હંદમાં આયોજન કરેલ તે દરમિયાન કુલાય ગામ પાસેની જાઈમાં એ બસે વર્ષ દરમિયાન મસ્કતી લટોરા નોંધેલ અને તેમાંના અમુકને જાળી વડે પકડી કરી પહેરાવેલ. ત્યાં કામ કરતાં વૈજ્ઞાનિકો, સર્વ શ્રી અસદ અખ્તર અને જુગલ કિશોર તિવારીએ આ પક્ષીને નિયમિત રીતે જોયેલા. ૧૯૮૧-૮૨ના બે વર્ષ દરમિયાન ડો. અસદ રહેમાનીની દેખરેખ હેઠળ શ્રી જે.કે. તિવારી ઘાસિયા જમીનનો અભ્યાસ કરવા કુલાયમાં જ રોકાયેલા. તે વખતે પણ આ પક્ષી સારી સંખ્યામાં નોંધાયેલું. વધુમાં વધુ શ્રી તિવારીએ મસ્કતી લટોરા એક જ દિવસમાં કુલાય ગામની સીમામાં લેખ્યા હતા. આમ હાલનાં વર્ષોમાં આ પક્ષીની સંખ્યામાં બલુચિસ્તાનથી કચ્છ સુધી વધારો થયો છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે, જે પક્ષી અગાઉ વિરલ હતું તે હવે વધારે સંખ્યામાં શા માટે જોવામાં આવે છે? છેક અન્ધાનિસ્તાન અને દીરાન સુધી પૂરતી તપાસ બાદ જ એ પ્રશ્નનો જવાબ મળી શકે.

ધજા સમય સુધી બે જ્યાચર પક્ષી કચ્છ અને સૌરાધ્રમાં વિરલ હતાં. એક હતું મોટી ચોટીલી ઝૂલ્કી (Greatcrested Grebe) અને બીજું, વાપોમરી (Slenderbilled Gull). છેલ્લાં વીસ વરસમાં આ બસે પક્ષીઓ નિયમિત રીતે જોવા મળે છે. મોટી ચોટીલી ઝૂલ્કી, ઓગાણીસમી સદીમાં કચ્છમાં નોંધાઈ હતી, પણ ત્યાર બાદ તે જોવા મળેલ નહીં. ૧૯૮૫માં મે મહિનામાં મારા જ્યોષ બંધુ, મહારાઓ-મદનસિંહજાને આ પક્ષી ભુજ પાસે રૂદ્રમાતા તેમમાં જોયાં અને અને તે બારામાં જણાવ્યું. તે પરથી હું જ્યારે ત્યાં ગથો ત્યારે મે ૨૭મી મે ના રોજ એ ડેમ પર છ મોટી ચોટીલી ઝૂલ્કી જોઈ. એ જ અરસામાં મારા પિતરાઈ ભાઈ નારસિંહજાને અને તેમનાં બચ્યાં જોયાં. ત્યાર બાદ, લગભગ બધા જગાશયોમાં આ પક્ષી જોવા મળે છે, અને તેનું પ્રજનન પણ નોંધાયું છે.

આવી જ રીતે વાધોમરી પણ સારી એવી સંખ્યામાં સમુદ્રની નાળો અને ડિનારા પર નિયમિત હાજરી પુરાવે છે.

ઉપરોક્ત બાબત વિશે એ અનુમાન કરી શકાય કે, હાલના સમયમાં એ પક્ષીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો હોવો જોઈએ અથવા તો જ્યાં તે અગાઉ જતાં ત્યાં તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ નથી અને તેથી તેઓ કચ્છમાં અને પાડોશી જગ્યાઓ સુધી પહોંચ્યાં છે.

પક્ષીવિજ્ઞાનની દૃષ્ટિયે કચ્છની એ વિશિષ્ટતા છે કે, એક તો આ મદેશ રશિયા અને મથ એરિયા ખંડમાંથી દર વર્ષ શિયાળો ગાળવા આવતાં પંખીઓના માર્ગમાં આવેલો છે અને બીજી તરફ અહીં ત્રણ મ્રકારનાં પર્યાવરણ અસ્તિત્વ ધરાવે છે. દરિયાઈ પર્યાવરણ (marine ecosystem) ઓછી વનસ્પતિ અને કાંઠાળી, રણને લગતી વનસ્પતિ વાળું પર્યાવરણ (semi-desert) અને ગ્રીજું, અફાટ રેટીમિશ્રિત માટીવાળાં નાના અને મોટા રણના ભાગ. આમ જુદી જુદી જીવસૂચિ માટેની અનુકૂળતા ધરાવતા આ પ્રદેશમાં સંબોધન અને નિરીક્ષણ માટે મેઝાન પડ્યું છે. સાથે સાથે, પર્ટિકો માટે સાંસું આયોજન થાય તો આર્થિક રીતે પણ દેશને ફાયદો થાય તેમ છે.


આ લેખ પૂરો કર્ય બાદ, શ્રી આર.ડી. જોઅન્ઝએ તેમણે અબદાસામાં નિલિયા પાસે જોયેલ મસ્કતી લટોરા (Stoliczka's Bushchat) ની તસવીરો મને બતાવી, તે ઉપરથી એ ફિલિત થાય છે કે, કચ્છમાં એક સદી બાદ ફરીથી આ પક્ષી જોવા મળ્યું છે.

જ્યુનિવિ ગ્રાઉન્ડ, બુજ-૩૬૦૦૦૧



### + આવકાર +

પ્રકૃતિમંડળ, સુરત દ્વારા ભારતીય પક્ષીઓ ના અવાજની કેસેટનો બીજો ભાગ પ્રસિદ્ધ થયો છે. તેમાં બીજાં ચલ પક્ષીઓના અવાજનો સમાવેશ કર્યો છે. કેસેટના પહેલા ભાગની પણ નવી આવૃત્તિ બહાર પરી છે. પ્રકૃતિમંડળ, સુરતનો આ પ્રયાસ ખરેખર પ્રશસ્તનીય અને આવકાર્ય છે.



ભારતીય પક્ષીઓના અવાજ : ભાગ-૨

કિંમત :- ૧૨૫/- રૂ.

પ્રાપ્તિશ્યાન : પ્રકૃતિમંડળ સુરત,  
C/O સ્લેહલ પટેલ, ૮૦ સર્જન સોસાયટી,  
અઠવા લાઈન્સ, સુરત-૩૬૦૦૦૧